https://archive.org/details/bk785/page/n0/mode/1up

1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)


All Items on https://archive.org/details/realpatidar

realpatidar.com

Full Library on https://realpatidar.com/library

શ્રી ઇશ્વરરામજી ગુરૂકુલ.

વાર્ષિક-વૃત્તાંત



ઇશ્વરનગર

विद्या धर्मेण शोभते

सा विद्या या विमुक्तये.

માગસર વદિ ૫ ૧૯૯૯.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n1/mode/1up

Real Patidar Library

https://www.realpatidar.com/library

This book/literature/article/material may be used for research, teaching, and private study purposes. Any substantial or systematic reproduction, redistribution, reselling, loan, sub-licensing, systematic supply, or distribution in any form to anyone is expressly forbidden.

The library does not give any warranty express or implied or make any representation that the contents will be complete or accurate or up to date. The library shall not be liable for any loss, actions, claims, proceedings, demand, or costs or damages whatsoever or howsoever caused arising directly or indirectly in connection with or arising out of the use of this material.

Full terms and conditions of use: http://www.realpatidar.com

About Real Patidar books

Real Patidar's mission is to organize the information on Satpanth religion, which is a Nizari Ismaili sect of Shia branch of Islam, and to make it universally accessible and useful. Real Patidar Books helps readers discover the material on Satpanth online while helping authors and researchers in their studies. You can know more by visiting http://www.realpatidar.com

You can resize and move this box in any PDF Application like Adobe Acrobat Reader.

Use the Bookmarks facility in the PDF to directly go to the pages containing Highlights.

For Reference See Pages: 7, 8, 9, 10, 14, 52.
For page numbers, see the page footer. Page numbers are in 'Page x of y' format

References by: RealPatidar.com - Created using: step2-QR-and-3-RM-v5.py

https://archive.org/details/bk785/page/n2/mode/1up


1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)

Digitally signed by realpatidar.com
DN: cn=realpatidar.com, c=IN, o=realpatidar.com, email=mail@realpatidar.com
Reason: I have reviewed this document
Date: 2026.02.19 15:43:14 +05'30'

realpatidar.com

શ્રી ઇશ્વરરામજી ગુરૂકુલ.

વાર્ષિક-વૃત્તાંત



ઇશ્વરનગર

विद्या धर्मेण शोभते सा विद्या या विमुक्तये.

માગસર વદિ ૫ ૧૯૯૯.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n3/mode/1up

realpatidar.com

સ્તુતિ.

હે દેવ ઇશ્વરરામ તમને, વાર વાર પ્રણામ હો !
આ મંજુ અંજલિ પ્રેમમય, અર્પિત પ્રભો અભિરામ હો ॥૧॥

સર્વસ્વ અર્પણ હો તમારા, પૂજ્ય ચરણોમાં સદા !
અમને તમારી સ્નેહમય, શુભ કામના આધાર હો ॥૨॥

સત્ય છો શિવ સુંદરમ્ છો, નિત્ય છો નિષ્કામ છો !
કુલમાં અમારા આપનું, ગુણગાન હો અવિરામ હો ॥૩॥

આપની શુભ દૃષ્ટિમાં, નિત પ્રેમ પારાવાર છે. !
આપની ગોદી અમારૂં, નિત્યનું વિશ્રામ હો ॥૪॥

ઇષ્ટ છો પ્રભુ આપ કુલના, કુલ તમારો પુત્ર છે !
સંબંધ હો અમથી સદા હો, નિત્ય હો નિષ્કામ હો ॥૫॥

realpatidar.com

https://archive.org/details/bk785/page/n4/mode/1up

realpatidar.com

ॐ

पूज्यपाद् ब्रह्मनिष्ठ महाराजश्री ઈશ્વરરામજી

ના

પવિત્ર સ્મારકમાં સ્થાપિત.

"શ્રી ઇશ્વરરામજી ગુરૂકુલ મંડલ" દ્વારા સંચાલિતઃ—

શ્રી. ઇશ્વરરામજી ગુરૂકુલ.

નો

વાર્ષિક વૃત્તાંત.

સં. ૧૯૯૫-૯૯

પ્રકાશકઃ—

ભિક્ષુ ઉદ્ધવદાસજી મહારાજ

સંસ્થાપક તથા આદ્યચાલક

પ્રત ૫૦૦ — હુતાશની

સં. ૧૯૯૯ — સને ૧૯૪૩

realpatidar.com

https://archive.org/details/bk785/page/n5/mode/1up

realpatidar.com

: શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ એટલે શું ? :

૧ શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ એટલે ધર્મ અને રાષ્ટ્રિયતાની સંગમભૂમિ.

૨ શ્રી ઇશ્વરરામજી ગુરૂળકુળ એટલે જ્ઞાન, જીવન અને બલની પૂણ્યભૂમિ.

૩ શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ એટલે આત્મિક, માનસિક અને શારીરિક ઉન્નતિના ઇચ્છુક વીરકુમારોની સાધનાભૂમિ.

૪ શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ એટલે કચ્છની ઉગતી પ્રજાને તેજસ્વી જ્ઞાનશાળી, અને બળશાળી બનાવવાનું કચ્છનું એક અપૂર્વ જ્ઞાન તીર્થ.

૫ શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ એટલે હિંદુઆદર્શ, હિંદુભાવનાં, હિંદુસંસ્કૃતિ અને હિંદીભાષાને ઉત્તેજન આપનાર હિંદુઓનું એક અપૂર્વ વિદ્યામંદિર.

૬ શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ એટલે સમસ્ત કચ્છમાં બ્રહ્મચર્ય અને ધાર્મિક અને રાષ્ટ્રિય શિક્ષણ આપનાર એક માત્ર સંસ્થા.

૭ શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ એટલે કચ્છનાં મહાનસંત પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ શ્રી ઇશ્વરરામજીનું પવિત્ર સ્મારક.


૮ શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ એટલે મધ્યમ અને ગરીબ સ્થિતિના કચ્છી ભાઇઓનાં બાળકોને તાલીમ આપવાનું મુખ્ય મથક.

૯ શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ એટલે સુરમ્ય ઇશ્વરસાગરને તીરે પ્રકૃતિના ખોળામાં સ્વાધીન અને મનોરમ્ય વાતાવરણમાં ઉછળતા અને નૂતનયુગની કેળવણી લેતા નવયુગના સર્જક બ્રહ્મચારીઓની વિહારભૂમિ.

realpatidar.com

realpatidar.com

શ્રી ઇશ્વરરામજી ગુરૂકુલઃ—



મહારાજ શ્રી ઈશ્વર રામજી.

જેમના પુણ્ય પ્રતાપે આજે ઇશ્વરનગર અનેકવિધ લોકોપયોગી
પ્રવૃત્તિઓનું ધામ બન્યું છે,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n7/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk785/page/n8/mode/1up

realpatidar.com

ટૂંક—નિવેદન.

શ્રી ઇશ્વરરામજી ગુરુકુળ પુજ્યાદ્ શ્રી ઇશ્વરરામજી મહારાજની તપોભૂમિ વાંઢાય કે જે હાલે ઈશ્વર-નગર ના પ્રચલિત નામે ઓળખાય છે, તે પૂજ્ય પુરૂષની પૂણ્યભૂમિમાં ખાસ કરીને કચ્છનાં ગરીબ સંતાનોને માટે એ ગુરૂની કુલભૂમિમાં કચ્છની દાનવીર પ્રજાની ઉદાર સખાવતથી સંવત ૧૯૯૩ ની વસંત-પંચમીને દિવસે સ્થાપિત થયું, તેનો લાંબો કે ટૂંકો ઇતિહાસ આથી અગાઉ સંવત ૧૯૯૪ અને ૯૫ ની સાલમાં પ્રગટ થએલ. વાર્ષિક વૃતાં-ત્તમાં હું મારા આરંભિક નિવેદનમાં દર્શાવી ગયો છું જેથી ફરી વિસ્તા-રપૂર્વક જણાવવાની આવશ્યક્તા નથી.

Ishwarnagar Sthapna
15-Feb-1937

સંજોગોવશાત સંવત ૧૯૯૫-૯૬ પછી સંસ્થાની પ્રગતિનો વાર્ષિક અહેવાલ પ્રગટ થઈ શકયો નથી એ અમારી ભૂલ જણાય તો દરગુજર કરશો.

કચ્છીજનતા પર પૂર્ણ વિશ્વાસ રાખી સંસ્થાનું સંચાલન ચાલુ રહ્યું સંસ્થાના ધ્યેય કે ઉદ્દેષ્યને અનુલક્ષી નિઃશુલ્ક ધોરણે લગભગ ૨૫ થી ૩૦ ગરીબોના સંતાનો પાછળ દરવર્ષે કોરી પંદરથી વીસ હજાર નો ખર્ચ છેલ્લા ત્રણ વર્ષ થયા કરેલો છે કે જે શ્રી ઇશ્વરરામજી ગુરુ-કુળનો મુખ્ય ઉદ્દેષ્ય હતો અને તેટલી રકમ તો દરવર્ષે કચ્છ કે કચ્છથી બહાર એક યા બીજી રીતે પ્રયાસ કરતાં કચ્છની શ્રદ્ધાળુ પ્રજા સ્હેજે પોતાની શ્રદ્ધા ભક્તિથી આપી દે તેવી આ ભિક્ષુકની અનુભવી આશા હતી. પરંતુ દેશના દુર્ભાગ્યે ૧૯૯૬ માં ભયંકર દુષ્કાળ પડ્યો, અને તે પછી જાગેલું વિશ્વયુદ્ધ.

આવી અનેક અકલ્પનીય આફ્ત કે પરિવર્તન ને લીધે સ્વાભાવિક મળી રહેતા દાનની મારી ધારણા અને આશા નીષ્ફળ નીવળી તે સાથે ચાલુ દાનનો પ્રવાહ પણ લગભગ બંધ થઇ ગયો, અને સંસ્થાને વખતો વખત દાન આપનાર કેટલાક શ્રદ્ધાળુ સજ્જનોની શ્રદ્ધા પણ ઓછી થતી ગઇ તે દરમિયાન સંસ્થાના સંચાલનની દૃષ્ટિએ આ ભિક્ષુકને કેટલાક કડવા મીઠા અનુભવો થયા.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n9/mode/1up

1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)

realpatidar.com

વધુમાં મારા જીવનની મર્યાદા અને ઉપયોગીતા તરફ ખ્યાલ કરતાં મને લાગ્યું કે આ લોકોપયોગી સંસ્થા પ્રત્યે જે ફરજ મારી છે તેવી અને તેટલી ફરજ ટ્રસ્ટી મંડળ તેમજ કાર્યવાહક મંડળની છે અને જાહેર જનતાની પણ છે, એમ ધારી ક્રિયાત્મક નિવૃત્તિ લેવાની ધારણાથી એક બે વખત સંસ્થાની સામાન્ય સભા બોલાવી. સંસ્થાના હિતાર્થે યોગ્ય લાગે તેવો સંચાલક નીમી મને નિવૃત્ત કરવા સભા સમક્ષ સંસ્થાની સ્થાવર જંગમ મિલકત અને આવક જાવકના હિસાબ સાથે મેં મારા તમામ વિચારો દર્શાવ્યા અને કોઇ એક કે વધુ વધુ વ્યક્તિઓ સંસ્થાની જવાબદારી લઇ મને મુક્ત કરવા કહ્યું. પરંતુ પોતપોતાના ધંધા અને વ્યવહારમાં પ્રવૃત્ત રહેલા ગૃહસ્થો પૈકી કોઇ સંસ્થાનું સંચાલન લેવા તૈયાર ન થયું અને એની એજ જવાબદારી મારા પર રહી.

પ્રભુ પાસે પ્રાર્થના પણ કરી. અને મારા પ્રત્યે શ્રદ્ધા કે ભક્તિ દર્શાવનારા મારા અનન્ય સેવકોને કચ્છ અને મુંબઈ વસતા મારા કચ્છી ભાઇઓને પત્રો લખી મારી યોજના રજુ કરી અને આ સંસ્થાની ક્રિયાત્મક જવાબદારીથી મુક્ત કરી ઇશ્વરપરાયણ રહેવા મારી ઇચ્છા દર્શાવી. મારા કે સંસ્થાના સદ્‌ભાગ્યે મેં નક્કી કરેલા બાવીસ સજ્જનોએ કેવળ સેવાભાવે તેમજ નિ:સ્વાર્થપણે મારા પ્રત્યેની સાચી શ્રદ્ધા કે ભક્તિવડે આવી વિપરીત પરિસ્થિતિમાં સહર્ષે આ સંસ્થાનું સુકાન પોતાના હાથમાં લઇ મારી ધારણા અનુસાર માગસર વદિ ૫ થી મને દરેક રીતે મુક્ત કર્યો જે હકીકત વર્તમાનપત્રોદ્વારા કે બીજીરીતે જાહેર થઇ ચૂકી છે.

ઇશ્વર એ બાવીસ કર્મવીર સાચા દેશપ્રેમી સેવાભાવી સજ્જનોનાં મનોરથ પૂર્ણ કરી દીર્ઘાયુષ્ય આપે.

પરોક્ષ કે અપરોક્ષ દૃષ્ટિએ આત્મભાવે એ બાવીસ સભ્યોને મારા હાર્દિક આશીર્વાદ છે.

આ તીર્થભૂમિમાં સ્થાપિત થએલ સંસ્થા ખાસ કરીને ગરીબોનાં સંતાનોનાં વિદ્યાભ્યાસ માટે સ્થાપિત થએલ છે. તેને કચ્છનાં ગરીબો કે ધનકુબેરો જ્યાં હોય ત્યાંથી બનતી સહાયતા આપે અને પોતાની દાનગંગાનો પ્રવાહ આ તરફ વાળે, અને સાચા સાધુ મહાત્માઓ આશીર્વાદ આપે કે જેથી આ વિદ્યારૂપી કલ્પતરૂ ફૂલેફાલે ને કચ્છનાં સેંકડો ગરીબ બ્રહ્મચારીઓ અહીં આશ્રય પ્રાપ્ત કરી વિદ્યાનું મધુરૂં પાન કરે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk785/page/n10/mode/1up

realpatidar.com

આ સંસ્થામાં અનેક શ્રીમાનો તેમજ ગરીબોએ પોતાની શ્રદ્ધા-ભક્તિથી દરેક પ્રકારે દાન આપેલ છે. વધારામાં હાલ આ સંસ્થાની સંરક્ષક સમિતિના પ્રમુખપદે નિયુક્ત થએલ શ્રીમાન્ ભાનુશાલી શેઠ હરિદાસભાઇ વેલજી (કચ્છ–ગોધરાવાલા) હાલ મુંબઇવાલા તરફથી મળતી શિષ્યવૃત્તિથી ચાર બ્રહ્મચારીઓ છેલ્લા પાંચ વર્ષ થયાં અધ્યયન કરી રહ્યા છે. તેનું અનુકરણ અન્ય દાનવીરો કરે એમ ઇચ્છું છું.

કચ્છની દાનવીર પ્રજા ઉપરોક્ત સંસ્થાને મદદ કરી પ્રાતઃસ્મરણીય શ્રી ઇશ્વરરામજી મહારાજના અમર આત્માનો આશીર્વાદ મેળવે એમ ઇચ્છું છું અને તે સાથે સનાતન ધર્મના અને રાષ્ટ્રના ચણાતા નવમંદીરના પાયામાં પોતાનું અમર સ્મારક મૂકવાનું નજ ચૂકે એવી આ ભિક્ષુકની નમ્ર સૂચના છે.

વિશેષ મારે જણાવવું અસ્થાને છે. મને વિશ્વાસ છે કે કચ્છી ભાઇઓ પોતાની માતૃભૂમિને આંગણે સ્થાપિત થએલ ગુરુકુળને તન, મન અને ધનથી પોષશે અને પોતાના આત્મત્યાગથી કચ્છ ભૂમિનું મસ્તક બંધારણના નિયમાનુસાર ટ્રસ્ટીમંડળ કે કાર્યવાહકમંડળ મારી જેમ આ સંસ્થાની ભાવિ પ્રગતિને અંગે જવાબદારી લઇને ક્રિયાત્મક કાર્ય ન કરે કે ન કરી શકે તો આ સંસ્થાના હિતાર્થે કોઇ ભાવિ યોજના સ્વતંત્રપણે કરી શકાય એ ઉદ્દેશ્યથી ગતવર્ષે તા. ને રોજે બોલાવેલી સામાન્યસભામાં થએલા ઠરાવ અનુસાર બંધારણ રદ થઇ ટ્રસ્ટી મંડળ તેમજ કાર્યવાહક મંડળના સભ્યો પોતાના હોદ્દાથી નિવૃત્ત થયા અને સંસ્થાની બધી જવાબદારી આ ભિક્ષુકપર આવી પડી.

ઇશ્વર પર શ્રદ્ધા રાખી પ્રથમની જેમ સંસ્થાના પ્રચાર અર્થે શ્રીમાનો કે અન્ય સજ્જનોને દ્વારે ન જતાં વધુ ઇશ્વર પરાયણ રહેવાની દૃષ્ટિએ ઇશ્વરનગરના ઇશ્વરસાગરને કિનારે લગભગ પંદરસો ફીટને અંતરેની એક ટેકરી પર પર્ણકુટિ બંધાવી મેં મારૂં નિવાસ-સ્થાન ત્યાં રાખ્યું કે જે અદ્યાપિ પર્યંત કાયમ છે. ત્યાં બેઠે પરોક્ષ કે અપરોક્ષરીતે બુદ્ધિ અનુસાર માગસર વદ ૫ સુધી ઉપરોક્ત સંસ્થાનું યોગ્ય સંચાલન ચાલુ રાખ્યું.

આજે ૩૬ બ્રહ્મચારીઓ આ ગુરુકુળમાં રહી સંધ્યા, હોમ, હવન દૈનિક-ક્રિયા ઉપરાંત ગીતા, રામાયણ જેવા ધાર્મિક ગ્રંથોનું જ્ઞાન લેવા સાથે વિદ્યાભ્યાસમાં સંસ્કૃત, હિંદી, ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું

realpatidar.com

https://archive.org/details/bk785/page/n11/mode/1up

1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)

realpatidar.com

અધ્યયન કરી રહ્યા છે. ઉપર દર્શાવેલા બ્રહ્મચારીઓની સંખ્યામાં લગભગ ૮૦ ટકા ગરીબોનાં બાળકો છે, કે જે નિઃશુલ્ક ધોરણે રહ્યા છે.

કચ્છની અસહ્ય મોંઘવારીને લીધે ગરીબ માતાપિતાઓ પોતાનું પોષણ કરવા જ્યાં અસમર્થ હોય ત્યાં શુલ્ક કયાંથી આપી શકે ? અને આવી વિકટ પરીસ્થિતિમાં સંસ્થા પાસે સ્થાયીફંડ ન હોવાથી સંસ્થામાં વર્તમાન કે ભાવિ સંચાલન મુશ્કેલી ભરેલું જણાય એ સ્વાભાવિક છે.

કચ્છનાં ગરીબોનાં વ્હાલસોયાં સંતાનોનાં હિતાર્થે માનવ સેવાની લાગણીથી દોરાઇ સંસ્થાનો પ્રેરક કે નિમિત્ત ઇશ્વરે આ ભિક્ષુને બનાવ્યો અને જે શ્રદ્ધાભક્તિવળે કચ્છી જનતાએ મને સાથ અને સહકાર આપ્યો તે રીતે આ કટોકટીની પળે આ સંસ્થાના ભાવિ સંચાલન માટે કાંઇ યોગ્ય ઉકેલ ન આવે તો સંસ્થાનું ભાવિ ભયમાં મૂકાઇ જવા સંભવ હતો. અને લોક દૃષ્ટિએ આવી લોકોપયોગી સંસ્થાની આબરૂ જેવી આ ભિક્ષુકની હતી કે હોય તેવી કચ્છી જનતાની પણ ગણાય.

સંસ્થા ઉદ્દેશ્યને બાધ ન આવે તે રીતની કોઇ કાયમી યોજના કરી વિદ્યા અને ધર્મપ્રેમી સજ્જનોનું એક ટ્રસ્ટમંડળ કે સંરક્ષક સમિતિ નીમી તેમને પૂર્ણ સત્તા સાથે આ સંસ્થા સુપ્રત કરી ક્રિયાત્મક દૃષ્ટિએ દરેક રીતે નિવૃત્ત થવા છેલ્લા ચાર માસ થયા મેં ખૂબ વિચારણા કરી તે સાથે ઉચું રાખીને એક સ્વરથી અભિમાનપૂર્વક કહેશે કેઃ—

આય વલો અસાંજો વતન
મુંજી માતૃભૂમિકે નમન.

કાગળની તેમજ છપાઇની અસહ્ય મોંઘવારીને લીધે કોરી ૨૫) તથા રૂ. ૧૦)થી નીચેના દાનદાતાઓના નામ એકંદર દર્શાવેલ રકમમાં ગણી લીધેલ છે. જુદાં નામ ઉપરોક્ત કારણસર દર્શાવેલ નથી જે ભૂલ જણાય તેવા દાનદાતાઓની દરગુજર ચાહું છું.

ૐ શાંતિ ૐ શાંતિ ૐ શાંતિ

નિવેદક—
ભિક્ષુ ઉફ્દદાસ
આદ્યચાલક—"શ્રી ઇશ્વરરામજી ગુરુકુળ વિદ્યાલય."

realpatidar.com

realpatidar.com



શ્રી ઇશ્વરરામજી ગુરૂકુલ વિદ્યાલયના સંસ્થાપક

મહારાજશ્રી ભિક્ષુ ઉદ્ધવદાસજી.

ઈશ્વરનગર (કચ્છ)

realpatidar.com

https://archive.org/details/bk785/page/n13/mode/1up

realpatidar.com

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk785/page/n14/mode/1up

realpatidar.com

શ્રી ઇશ્વરરામજી ગુરુકુળ વિદ્યાલય.

સંસ્થાપક તથા આદ્યચાલક-શ્રી ભિક્ષુ ઉદ્ધવદાસજી (મહારાજ)

સંરક્ષક—સમિતિ.

૧	શ્રીમાન	શેઠ	શ્રી ભાનુશાલી હરિદાસભાઇ વેલજી (ગોધરા-કચ્છ) હાલ મુંબઈ—[પ્રમુખ]
૨	,,	,,	શ્રી મનજીભાઇ જેરામ રાઠોડ (મધાપુર-કચ્છ) [ઉપપ્રમુખ]
૩	,,	,,	શ્રી વકીલ શ્રી ગોપાલજીભાઇ ઉમરસિંહ-ભૂજ ,,
૪	,,	,,	શ્રી માંડણભાઇ ભાણજી પરમાર (કુકમા)—[મંત્રી]
૫	,,	,,	શ્રી વિશનજીભાઇ કાનજી ઓફ (મુંબઇ) [મુંબઇ શાખાના મંત્રી]
૬	,,	,,	શ્રી કાનજીભાઇ દયાળ મોટાણી જખૌ (કચ્છ) [ઉપમંત્રી]
૭	,,	,,	શ્રી છગનલાલભાઇ વેલજી ગોધરા (કચ્છ)-[ખજાનચી]
૮	,,	,,	શ્રી વીરજીભાઇ વિશ્રામ કોઠારી મંજલ (કચ્છ) ,,
૯	,,	,,	શ્રી મૂલજીભાઈ ભાણજી પરમાર કુકમા (કચ્છ) [મુખ્યાધિષ્ઠાતા]
૧૦	,,	,,	શ્રી કાનજીભાઇ મોતી પંચાણ—મુંબઇ
૧૧	,,	,,	શ્રી ભીમજીભાઇ રતનશી રૂપારેલ—મુંબઇ
૧૨	,,	,,	શ્રી ઠાકરસિંહભાઇ નરસિંહ કોઠારી—,,
૧૩	,,	,,	શ્રી ખીમજી ભાઇ શામજી પોપટ —,,
૧૪	,,	,,	શ્રી કૃષ્ણદાસભાઇ હીરજી પંજુઆણી—,,
૧૫	,,	,,	શ્રી મોનજીભાઇ ગાંગજી પોપટ —,,
૧૬	,,	,,	શ્રી જાદવજીભાઇ રતનશી —,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n15/mode/1up

realpatidar.com

૧૭ „ „ શ્રી મૂળશંકરભાઇ કુંવરજીભાઇ વકીલ-ભૂજ
૧૮ „ „ શ્રી ગાંગજીભાઇ જેરામ વકીલ—બિટ્ટા
૧૯ „ „ શ્રી વાલજીભાઇ રતના રાઠોડ—માધાપુર-કચ્છ
૨૦ „ „ શ્રી કુંવરજીભાઇ ગોકુળ પઢીઆર—અંજાર-કચ્છ
૨૧ „ „ શ્રી રતનશીભાઇ ખીમજી—વીરાણી-કચ્છ
૨૨ „ „ શ્રી નથુભાઇ નાનજી—નખત્રાણા-કચ્છ

ઑડિટરો.

૧ વકીલ શ્રી સુરજીભાઇ ઉંમરસિંહ—ભૂજ.
૨ રા. રા. શ્રી જીવરામભાઇ મોનજી ન્યાયાધિશ—માંડવી.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n16/mode/1up

1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)

realpatidar.com

શ્રી ઇશ્વરરામજી ગુરુકુળનો સંક્ષિપ્ત પરિચય.

સંવત્ ૧૯૯૫ ના પોશ શુદ ૧ થી ૧૯૯૯ ના માગસર વદિ ૪ સુધી.

(૧) સ્થાપના	(૨) સ્થળ	(૩) સંસ્થાપક અને	(૪) રેલ્વે સ્ટેશન	(૫) વાહન મોટર	(૬) સંરક્ષક સમિતિ
મહા શુદ ૫ વસંતપચમી ૧૯૯૩	સુપ્રસિદ્ધ ઇશ્વરરામજી આશ્રમની પાસે ઇશ્વરસાગરની તીરે	આદ્યચાલક શ્રી ભિક્ષુ ઉદ્ધવદાસજી (મહારાજ)	ભૂજથી નખત્રાણા રોડપર ૧૬ માઇલને અંતરે.	દેસલપુર સ્ટેન્ડ સુધી રા૪ ભૂજ નખત્રાણા રોડ	૨૨ સભ્યો

(૭) પ્રમુખ	(૮) મંત્રી	(૯) મુખ્યાધિષ્ઠાતા	(૧૦) આચાર્ય	(૧૧) સ્થાવર મિલ્કત	(૧૨) વાર્ષિક શુલ્કની આવક
ભા. શેઠ. શ્રી હરિદાસભાઇ વેલજી	શ્રી માંડણભાઇ ભાણજી કુકમા. શ્રી વિશનજીભાઇ કાનજી મુંબઇ. શ્રી કાનજીભાઇ દયાળ ઇશ્વરરામજી ગુરુકુળ.	શ્રી મૂલજીભાઇ ભાણજી ઇશ્વરરામજી ગુરુકુળ	શ્રી કાનજીભાઇ દયાળ મોટાણી	૧) જમીન વાંઢાયના સિંધલ રજપુત ભાઇઓ તરફથી કૃષ્ણાર્પણમાં મળેલછે. ૨) મકાન ૧૮૭૯૬૧ાા. ૩) સ્થાવર સામાન ૪૯૦૬૭૨)	સં. ૧૯૯૫ કો. ૪૬૬૧) સં. ૧૯૯૬ કો. ૧૯૦૯૯) સં. ૧૯૯૭ કો. ૧૯૩૦) સં. ૧૯૯૮ કો. ૭૨૦) રૂા. ૪૩૯)

૭

(૧૩) ફીના નિયમ	(૧૪) વાર્ષિક ખર્ચ કેવળ ભોજન	(૧૫) બ્રહ્મચારીઓની પ્રવેશ ઉંમર	(૧૬) બ્રહ્મચારીની સંખ્યા	(૧૭) શ્રેણીનાં સંખ્યા	(૧૮) અધ્યાપકોની સંખ્યા
નિઃશુલ્ક શિક્ષણ પરંતુ યથા શક્તિ દાન સ્વરૂપે સ્વીકારવામાં આવશે.	સં. ૧૯૯૫ કો. ૮૦૧૦)૪ સં. ૧૯૯૬,, ૨૩૮૫૭ાર સં. ૧૯૯૭,, ૧૨૧૨૧ાપાા સં. ૧૯૯૮,, ૨૨૩૯૬ાાાર	૯ થી ૧૧ વર્ષ સુધી	૩૬	૭	૪

realpatidar.com

https://archive.org/details/bk785/page/n17/mode/1up
1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)
realpatidar.com

(૧૯) વિદ્યાલયનો	(૨૦) નિત્ય કર્મ	(૨૧) અભ્યાસની	(૨૨) અન્ય વિષયો	(૨૩) હાથ ઉદ્યોગ	(૨૪) ભોજન
સમય	સંધ્યા શ્વાસના	ભાષાઓ	ગણિત	કાંતણુ	સવારે-દૂધ રોટલા
ાાા થી ૧૦ાા	અગ્નિ હોત્ર	૧) ગુજરાતી	ધર્મશિક્ષા	બાગાયત	બપોરે-રોટલી, દાળ,
૨ા થી ૪	દેવ-દર્શન	૨) હિંદી	ઇતિહાસ		ભાત, શાક, ઘી,
	અધ્યયન આદિ	૩) સંસ્કૃત	ભૂગોળ		માખણુ. ગોળ
		૪) ઇંગ્લીશ	ચિત્રકળા		સાંજે-ખીચડી, કઢી,
			સંભાષય-વિજ્ઞાન		રોટલા, દૂધ,
					ઓસામણુ, ભાત

(૨૫) દૈનિક ભોજન	(૨૬) શારીરિક	(૨) સંગઠિત રમતો	(૨૮) વાર્ષિક રજાઓ	(૨૯) શિષ્યવૃત્તિ બે પ્રકારની	(૩૦) વાર્ષિક ઉત્સવ
વ્યય	વ્યાયામ	ફૂટબોલ,	વૈશાખ, જેઠ અથવા	૧) કોરી.૫૦૦૦)માં એક	ચૈત્ર સુદ ૯-૧૦-૧૧
બ્રહ્મચારી દીઠ	લાઠી, લેઝિમ, મગદડ,	ગેડીદડા,	અન્ય અનુકુળ સમયે	બ્રહ્મચારીનો પૂર્ણ	રામનવમીના
કોરી ૧૧	દંડ, બેઠક, આસન	ખો ખો,	કુલ એક માસની રજા	અભ્યાસ ૨) કોરી.	પર્વ પર.
	વગેરે.	હુ તુ...તુ,		૧૫૦૦૦) કાયમ માટે	
		તથા અન્ય બાલ		એક બ્રહ્મચારી ગુરુકુ-	
		રમતો		ળમાં ભણી શકે છે.	

(૩૧) બ્રહ્મચારીના	(૩૨) કોરી. ૫૦૦)	(૩૩) કોરી. ૧૦૦૦)	(૩૪) કોરી. ૫૦૦૦)	૩૫ ભૂમિદાન દાતા-	(૩૬) ઇશ્વરનગરની
પ્રવેશનો સમય	અથવા તેથી વધુ	અથવા તેથી વધુ	અથવાતેથીવધુ૧૦૦૦૦	ઓની સંખ્યા	પ્રવૃત્તિઓ
વાર્ષિક ઉત્સવ પ્રસંગે	આપનાર દાનીઓની	આપનાર દાની-	સુધીઆપનાર દાની-	૧૨	ગૌશાળા
રામનવમીના પર્વ પર	સંખ્યા	ઓની સંખ્યા	ઓની સંખ્યા		સંતદ્વાર
અથવા નવા સત્રના	સં. ૧૯૯૫ ના પોષ શુદ	સં. ૧૯૯૫ના પોશ	સં. ૧૯૯૫ના પોશ શુદ		
આરંભમાં	૧ થી સં. ૧૯૯૯ ના	શુદ ૧ થી સં. ૧૯૯૯	૧ થી સં. ૧૯૯૯ ના		
	માગસર શુદ ૪ સુધી	ના માગસર શુદ ૪	માગસર વદિ ૪ સુધી		
	સંખ્યા ૧૩	સુધી સંખ્યા ૮	સંખ્યા ૨		

realpatidar.com

https://archive.org/details/bk785/page/n18/mode/1up

realpatidar.com

— શ્રી ઇશ્વરરામજી ગુરુકુળનાં બ્રહ્મચારીઓનો —
દૈનિક—કાર્યક્રમ.

થી	સુધી	કાર્યક્રમ	વિશેષ સૂચના
	૪—૩૦	ઉત્થાન	ઋતુ અનુસાર સમય-વિભાગમાં આવશ્યકતા પ્રમાણે ફેરફાર કરવામાં આવશે.
૪—૩૦	૫—૦	શૌચ વિગેરે	
૫—૦	૫—૧૫	દંત ધાવન	
૫—૧૫	૬—૦	સામુહિક પ્રાર્થના અને વ્યાયામ	
૬—૦	૬—૧૫	નિવાસગૃહ સફાઈ	
૬—૧૫	૬—૪૫	સ્નાન—વસ્ત્ર પ્રક્ષાલન	
૬—૪૫	૭—૧૫	દુગ્ધપાન	
૭—૧૫	૭—૪૫	સંધ્યા હવન	
૭—૪૫	૧૦—૩૦	વિદ્યાલયમાં અધ્યન	
૧૦—૩૦	૧૧—૩૦	ભોજન અને વિશ્રામ	
૧૧—૩૦	૧૨—૦	પત્ર—પત્રિકા વાંચન	
૧૨—૦	૧૨—૩૦	કાંતણ વર્ગ	
૧૨—૩૦	૨—૦	સ્વાધ્યાય	
૨—૦	૨—૧૫	નાસ્તો	
૨—૧૫	૪—૦	વિદ્યાલયમાં અધ્યન	
૪—૦	૪—૩૦	શૌચ તથા બાગાયત	
૪—૩૦	૫—૪૫	રમત—ગમત વ્યાયામ	
૫—૪૫	૬—૦	પ્રાર્થનાની તૈયારી	
૬—૦	૬—૧૫	સામુહિક પ્રાર્થના	
૬—૧૫	૭—૦	ભોજન	
૭—૦	૭—૩૦	આરામ	
૭—૩૦	૮—૩૦	રાત્રી પ્રવૃત્તિ (સંગીત, સંવાદ, ધર્મગ્રંથોનું શ્રવણતથાવાર્તાલાપ)	
૮—૩૦	૮—૪૫	પ્રાર્થના તથા શયન	

realpatidar.com

https://archive.org/details/bk785/page/n19/mode/1up

realpatidar.com

— શ્રી ઇશ્વરરામજી ગુરુકુળ ભોજન ભંડારનું દૈનિક ભોજન-પત્રક. —

વાર	પ્રાતઃ	મધ્યાનઃ	સાયંમ	સૂચના
સોમ	નાસ્તો	ખીર, રોટલી કઠોળ	ખીચડી, કઢી, રોટલા	(૧) દરોજ બપોરના ભોજનમાં છાસ તેમજ સાંજે દૂધ અપાય છે.
મંગળ	દૂધ	રોટલા (બાજરાના) લીલોતરી અથાણું	,,	(૨) વિદ્યાર્થી દીઠ ૧ શેર દૂધ તથા ઘી ૨ તોલા અપાય છે.
બુધ	,,	રોટલી, ખાટામગ અથાણું	,,	
ગુરૂ	,,	રોટલા, મિશ્રિતદાળ, શાક	,,	(૩) બપોરના નાસ્તામાં-સેકેલ સેંગા, દાળીઆ મમરા, ચીકી, ખજુર, પપૈયા, ટમાટા, વિગેરે આપવામાં આવે છે.
શુક્ર	,,	રોટલી, શાક, કચુંબર	,,	
શનિ	,,	રોટલા, શાક, ગોળ, માખણ	,,	(૪) નિયત સમયે મિષ્ટાન તથા મોસમી ફળો બ્રહ્મચારીઓને મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
રવિ	,,	ખીચડી, કઢી, રોટલા	દૂધ, રોટલી, શાક	

realpatidar.com

https://archive.org/details/bk785/page/n20/mode/1up

realpatidar.com

બ્રહ્મચારીઓની શ્રેણીવાર સંખ્યા

ક્રમ	શ્રેણી	સંખ્યા
૧	ગુ. બાળવર્ગ	૪
૨	ગુ. પહેલી	૩
૩	ગુ. બીજી	૧
૪	ગુ. ત્રીજી	૬
૫	ગુ. ચોથી	૫
૬	ગુ. પાંચમી	૮
૭	ગુ. છઠ્ઠી	૧
૮	ગુ. સાતમી	૬
	બે વિદ્યાર્થીઓ ૪ થી તથા પાંચમીના વિશેષ વર્ગમાં છે.	૨
		૩૬

બ્રહ્મચારીઓની જાતિવાર સંખ્યા

ક્રમ	જાતિ	સંખ્યા
૧	બ્રાહ્મણ	૭
૨	જાડેજા રજપુત	૫
૩	ગુર્જર ક્ષત્રિય કડિયા	૧૦
૪	લોહાણા	૧
૫	ભાનુશાલી	૭
૬	કણબી	૨
૭	સોની	૧
૮	વાણીઆ	૧
૯	બારોટ	૧
૧૦	ગુર્જર લોહાર	૧
		૩૬

:– મકાનો –:

ગુરૂકુળ પ્રેમી, ઉદાર સજ્જનોની મદદથી અત્યાર સુધી બંધાઇ ગયેલા મકાનો.

૧ બ્રહ્મચારી નિવાસગૃહ.
૨ અતિથિ શાળાનાં ૧૩ ઓરડા.
૩ પરિવારગૃહના ૧૨ મકાનો.
૪ ચિકિત્સાલય.
૫ ભોજનશાળા.
૬ વ્યાયામશાળા.
૭ પાણીની ટાંકી
૮ સ્નાનગૃહ.
૯ એક વિશાળ વિદ્યાલયનું મકાન.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n21/mode/1up

realpatidar.com

— બ્રહ્મચારીઓની ગ્રામવાર સંખ્યા —

ક્રમાંક	ગામ	સંખ્યા
૧	કુભારીઆ	૪
૨	દેશલપુર	૪
૩	ભૂજ	૩
૪	અંજાર	૩
૫	જખૌ	૩
૬	મંજલ	૩
૭	કુકમા	૨
૮	નાગોર	૨
૯	નાગલપુર	૧
૧૦	ખેડોઇ	૧
૧૧	ડોણ	૧
૧૨	વમોટી	૧
૧૩	વનોરી	૧
૧૪	વાંઢાય	૧
૧૫	જામથરા	૧
૧૬	તરા	૧
૧૭	રેહા	૧
૧૮	કોજાચોરા	૧
૧૯	હાજાપુર	૧
૨૦	કલ્યાણપુર	૧
		૩૬

realpatidar.com

https://archive.org/details/bk785/page/n22/mode/1up

realpatidar.com

શ્રી ઇશ્વરરામજી ગુરુકુળ વિદ્યાલય (ઇશ્વરનગર) માં પળાતા
:— પર્વોની રજાઓ —:

પર્વનું નામ	કેટલા દિવસ	તિથિ કે તારીખ
૧ રામનવમી	૩	ચૈત્ર સુદ ૮–૯–૧૦
૨ કચ્છી નૂતન વર્ષ	૧	અષાડ સુદ ૨
૩ ગુરૂપૂર્ણિમા	૧	અષાડ સુદ ૧૫
૪ ઇશ્વરરામજીનિર્વાણતિથિ	૧	અષાડ વદિ ૨
૫ નાગપંચમી	૧	શ્રાવણ સુદ ૫
૬ બળેવ (રક્ષાબંધન)	૧	શ્રાવણ સુદ ૧૫
૭ જન્માષ્ટમિ	૨	શ્રાવણ વદ ૭–૮
૮ ગાંધી–જયંતી	૧	ભાદરવા વદ ૧૨
૯ દશેરા	૧	આસો સુદ ૧૦
૧૦ દિપોત્સવી	૪	આસો વદ ૧૩–૧૪–૦)) નૂતનવર્ષ
૧૧ શ્રદ્ધાનંદ બલિદાન તિથિ	૧	માગસર વદ ૧૦
૧૨ કચ્છ સ્વાતંત્ર્યદિન	૧	જાન્યુઆરી તા. ૨૬ મી
૧૩ મકર સક્રાંતિ	૧	પોષ
૧૪ વસંત પંચમી	૧	મહા સુદ ૫
૧૫ મહાશિવરાત્રિ	૧	મહા વદિ ૧૪
૧૬ હોળી	૧	ફાગણ સુદ ૧૫

realpatidar.com

realpatidar.com

સાં. ૧૯૯૫ ની સાલમાં સંસ્થાને દાન આપેલ

– દાન દાતાઓના નામ –

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૧	શ્રી અરજણભાઇ પ્રેમજી	ગુલબર્ગા	૧૫૦)	–	,,
૨	શ્રી અરજણભાઇ મનજી	,,	૫૧)	–	,,
૩	જાડેજા હેમુભા ગોવીંદજી	વેકરા	–	૧૦૦૦)	,,
૪	શ્રી લક્ષ્મીદાસભાઇ માવજી	મોટી વમોટી	–	૨૫૧	,,
૫	શ્રી પરસોતમભાઇ પ્રેમજી	રોહા	–	૫૧)	,,
૬	શ્રી લધાભાઇ પરસોતમ	,,	–	૫૦)	,,
૭	બેન પ્રેમલીલાબાઇ ઠાકરશી પૂજ્ય મહારાજશ્રીહસ્ત મળેલ દાન	,,	૧૦	–	,,
					વાર્ષિકદાન
૮	શેઠ શ્રી શુરજીભાઇ વલભદાસ	મુંબઇ	૫૦)	–	,,
૯	શેઠ શ્રી મોનજીભાઇ લાલજી હસ્તે રામાબાઇ	,,	૫૦)	–	,,
૧૦	ભાનુશાલી દયાલ દોશા	,,	૧૫)	–	,,
૧૧	ભાનુશાલી જાદવજીભાઇ રતનશી	,,	૧૫)	–	,,
૧૨	શેઠ શ્રી વીરજીભાઈ વિશ્રામ	,,	૨૫)	–	,,
૧૩	રાજગોર વીશનજીભાઈ કાનજી	,,	૨૫)	–	,,
૧૪	શેઠ શ્રી વેલજીભાઈ ડુંગરશી	,,	૫૦)	–	,,
૧૫	માતાજી ભાગબાઇમા, હસ્તે શેઠ શુરજીભાઈ વલભદાસ	,,	૫૦)	–	,,
૧૬	શેઠ શ્રી વીરજીભાઈ લધાભાઈ	,,	૪૦)	–	,,
૧૭	પાટીદાર રતનશીભાઈ ખીમજી	,,	૨૫)	–	,,
૧૮	ઠા. મેઘજીભાઇ મોરારજીના બેન મીઠમા	,,	૨૫)	–	,,
૧૯	ભાનુશાલી કલ્યાણજીભાઈ તેજપાલ	,,	૧૦)	–	,,
૨૦	ભાનુશાલી મીઠુભાઈ ભીમજીભાઈ	,,	૧૫)	–	,,
૨૧	ઠા. શામજીભાઇ કલ્યાણજી	,,	૧૦)	–	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n24/mode/1up

1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૨૨	ડા. હેમરાજભાઇ પરસોતમ	,,	૧૦)	—	વાર્ષિક દાન
૨૩	ભા. પટેલ કરમસીભાઇ ત્રીકમ	,,	૧૦)	—	,,
૨૪	શેઠ સુંદરજીભાઇ દેવચંદ હસ્તે તેમના ધર્મપત્નિ મોંઘીબાઇ	,,	૫૦)	—	,,
૨૫	માતુશ્રી સચ્ચીદાનંદ	,,	૫૦)	—	,,
૨૬	ડા. ગોકુળદાસભાઈ શામજી	,,	૨૫)	—	,,
૨૭	ડા. શામજીભાઇ લાલજી	,,	૨૫)	—	,,
૨૮	ભા. લક્ષ્મીદાસભાઇ માવજી	,,	૧૫)	—	સામાન્ય દાન
૨૯	ડા. તુલસીદાસભાઇ ત્રીકમદાસ	,,	૨૫)	—	,,
૩૦	શેઠ શ્રી વાસુદેવભાઈ જેઠાભાઇ હસ્તે માતાજી રાધાબાઇ	,,	૧૦૦)	—	,,
૩૧	શેઠ શ્રી પરસોતમભાઇ હીરજી	મુંબઇ	૫૦)	—	,,
૩૨	માતાજી દેવકાબાઇ	,,	૫૫)	—	,,
૩૩	ડા. લાલજીભાઇ નારાણજીના ધર્મપત્નિ ધનબાઇ	,,	૧૨–૮	—	,,
૩૪	પૂજ્ય દેવીશ્રીનાં શિષ્ય બેન બચુબાઈ	,,	૧૨–૮	—	,,
૩૫	ભાનુશાળી મોરારજીભાઈ ગાંગજી	,,	૧૦)	—	,,
૩૬	શેઠશ્રીદેવજીભાઇ કાનજી હસ્તે મીઠામા	,,	૫૧)	—	,,
૩૭	શેઠશ્રી કરસનદાસભાઈ કાનજી	,,	૨૫)	—	,,
૩૮	શેઠશ્રી લાલજીભાઇ રવજી ખાંટ	,,	૫૦)	—	,,
૩૯	શેઠશ્રી રણછોડદાસ જેરામદાસ એન્ડ સન્સ	,,	૧૦૧)	—	,,
૪૦	શેઠ શ્રી લાલજીભાઇ ડુંગરસી	,,	૨૫૧)	—	,,
૪૧	માતાજી જમનાબાઇ	,,	૧૦૧)	—	,,
૪૨	શેઠ શ્રી રામજી ગોવિંદજી હસ્તે હીરબાઇ (દેશલપુર)	,,	૧૦)	—	,,
૪૩	ડા. કરસનદાસ પરસોતમદાસ હસ્તે હીરબાઇ	,,	૧૨–૮	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n25/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૪૪	ડા. નારાણજીભાઇ પારપૈયા	,,	૨૫)	—	,,
૪૫	,, શીવજીભાઇ કુંવરજીભાઇ	,,	૧૧)	—	,,
૪૬	શેઠ શ્રી શુરજીભાઇ ત્રીકમદાસ	,,	૧૧)	—	,,
૪૭	,, શ્રી મોરારજીભાઇ કરસનદાસ હસ્તે શેઠ શ્રી ઠાકરશીભાઇ નરસી	,,	૨૫)	—	,,
૪૮	શેઠશ્રી પ્રેમજીભાઇ હરજીની ધર્મપત્ની ગંગાબાઇ હસ્તે વીરબાઇ	,,	૩૦૧)	—	,,
૪૯	શેઠ શ્રી પ્રાગજીભાઇ દયાળ હરિઆણી	,,	૧૨૫)	—	,,
૫૦	શેઠ શ્રી નાનજીભાઇ ટોકરસી	,,	૧૨૫)	—	,,
૫૧	,, શ્રી કાનજીભાઇ જાદવજી હસ્તે વેલાબાઇ	,,	૧૦૦)	—	,,
૫૨	ડા. નાનજીભાઇ ગોકલદાસ હસ્તે પરસોતમ નાનજી	,,	૫૧)	—	,,
૫૩	શેઠ શ્રી કેશવજીભાઇ મૂલજીની કું.	,,	૧૧-૪	—	,,
૫૪	શ્રી નારાણજીભાઇ ગોવિંદજી	ખડકપુર	૦	૫૦)	,,
૫૫	શ્રી કરમસીભાઇ ખોડાભાઇ	સીનોગરા	૦	૩૩૧)	,,
૫૬	શ્રી દામજીભાઈ શીવજીભાઇ હસ્તે શ્રી વીશનજીભાઈ કાનજી શ્રોફ	મુંબઇ (માટુંગા)	૫૦૧)	—	,,
૫૭	શેઠ લક્ષ્મીદાસભાઇ માવજી ગોપીંદજી	કોટડા	—	૨૫।	,,
૫૮	શ્રી જગમાલભાઇ ભીમજી, હસ્તે તેમના ધર્મપત્નિબાઇ ભાણીબાઇ	માધાપુર	૧૦૦૦)	—	,,
૫૯	શેઠ શ્રી ખીમજીભાઇ તથા શેઠ કાનજીભાઇ મોતીભાઇ	અંજાર	—	૩૩૩)	,,
૬૦	શેઠશ્રી ગોવરધનદાસભાઇ ટોકરસી હસ્તે માતુશ્રી લક્ષ્મીબાઇ	—	૦	૧૦૬॥	,,
૬૧	બ્રહ્મચારીઓ પ્રવાસમાં ગએલ ત્યારે તેમને ગામ—કુકમા, માધાપુર, ખંભરા વિગેરે ગામો તરફથી પ્રવાસ ફંડની મળી.	—	૦	૩૬૯)	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n26/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂ.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૬૨	શ્રી આણદાભાઇ કલ્યાણભાઈ	માધાપુર	૦	૨૫)	,,
૬૩	શ્રી પૂજ્ય સાધ્વી મૈયાજી પાસેથી બ્રહ્મચારીઓ માટે	મંજલ	૦	૬૦)	,,
૬૪	પૂજ્ય માહારાજશ્રી તરફથી નુતન વર્ષની	ઇશ્વિરનગર	૦	૫૦૦)	,,
૬૫	પચીસ કોરીથી ઓછી રકમ	—	૦	૧૦૫)	,,
૬૬	રૂપીઆ દસથી ઓછી રકમ	—	૧૫૦-૮	૦	,,

: સાં. ૧૯૯૬ માં દાન આપનાર દાન–દાતાઓના નામ :

૧	શેઠ ચુનિલાલભાઈ માણેકચંદ	ભૂજ	—	૨૫)	,,
૨	શેઠ શ્રી ગોપાલજીભાઇ રૂપચંદ	માનકુવા	—	૨૫)	,,
૩	આચાર્ય શ્રી વિનોદચન્દ્રજી વિદ્યાલંકાર	ઇશ્વિરનગર	૩૦)	—	,,
૪	શ્રી પુરૂષોતમ દેવ	,,	૧૦)	—	,,
૫	ડા. શ્રી લખમસિંહભાઇ માનસિંહ	,,	—	૩૦)	,,
૬	એક ગૃહસ્થ તરફથી હસ્તે ડૉ. વલભજી હંશરાજ (ચેકથી)	ભૂજ	૨૫)	—	,,
૭	ધી સીડસ એશોશિએશન તરફથી	મુંબઇ	૫૧)	—	,,
૮	ડા. ભીમજીભાઇ ખટાઉ	મંજલ	૧૦)	—	,,
૯	મીસ્ત્રી આણદાભાઇ કલ્યાણજી	માધાપુર	—	૨૫)	,,
૧૦	પટેલ શ્રી જીવરાજભાઈ હીરજી	માનકુવા	—	૧૦૦૦)	,,
૧૧	ખારેક બજાર મેવા મરચન્ટ ઓશોસિએશન તરફથી	મુંબઈ	૫૦)	—	,,
૧૨	ગ્રેઇન મરચન્ટ એશોસિએશન તરફથી	,,	૨૫૦)	—	,,
૧૩	શ્રી અરજણભાઇ પ્રેમજી ચંદીઆવાલા	ગુલબર્ગા	૨૦)	—	,,
૧૪	પટેલ શ્રી કરમશીભાઇ ત્રીકમદાસ	મુંબઇ	૧૦)	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n27/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર જળ પ્રબંધ દાન
૧૫	ભાઇ શ્રી કલ્યાણજી તેજપાલ જખૌ	,,	૧૦)	—	,,
૧૬	ભાઈ શ્રી જાદવજી રતનશી	,,	૧૫)	—	,,
૧૭	ભાઇ મોરારજી ગાંગજી	,,	૧૦)	—	,,
૧૮	ભાઈ શ્રી મીઠુ ભીમજી	,,	૧૫)	—	,,
૧૯	સાધુ શ્રી પ્રેમદાસજી	ઇશ્વરનગર	—	૩૫)	,,
૨૦	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	—	૨૫)	,,
૨૧	વકીલ શ્રી ગોપાલજીભાઇ ઉમરશી	ભૂજ	—	૧૦૦)	વાર્ષિકદાન
૨૨	ઉમરશીભાઇ પ્રાગજી હસ્તે શ્રી ગોપાલજીભાઈ	,,	—	૧૦૦)	,,

: જળ પ્રબંધ માટે મળેલ દાન :

૧	શ્રીમાન્ મનજીભાઇ જેરામ રાઠોડ	માધાપુર	૧૦૦)	—	જળપ્રબંધ
૨	શ્રી હીરજીભાઈ વિશ્રામ	હાજાપુર	૧૦૦)	—	,,
૩	ગંગાસ્વબાઇ ગંગાબાઇ શ્રી પ્રેમજીભાઇ હરજીના ધર્મપત્નિ	અંજાર	૩૦૦)	—	,,
૪	શેઠ શ્રી તુલશીદાસ ત્રીકમજી ખાંટ	દરસડી	૧૨૫)	—	,,
૫	ગંગાસ્વ માતુ શ્રી મીઠા મા તે શ્રી દેવજી કાનજીના ધર્મપત્નિ	તેરા	૧૦૧)	—	,,
૬	શેઠ ગોપાલભાઇ વાસુદેવ હસ્તે માતુ શ્રી રાધાબાઇ	લખપત	૧૦૧)	—	,,
૭	શ્રી વીરજીભાઈ નંદુ હસ્તે તેના ધર્મપત્નિ જાનકીબાઈ	મુંબઇ	૧૦૧)	—	,,
૮	પૂજ્ય શ્રી ગંગાસ્વ સાધ્વી મૈયાજી	મંજલ	૧૦૦)	—	,,
૯	ગંસ્વ માતાજી નેણબાઇમા	,,	૧૦૦)	—	,,
૧૦	શ્રીમાન્ પ્રેમજીભાઇ ખેંગાર પરમાર	કુકમા	૧૦૦)	—	,,
૧૧	શ્રીમાન્ રવજીભાઇ પુરૂષોત્તમ જોષી	મૂંન્દ્રા	૫૧–૪	—	,,
૧૨	શેઠ વેલજીભાઇ ભીમજી હસ્તે તેમના ધર્મપત્નિ વેલબાઇ	કોટડા	૫૧)	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n28/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂ.	કોરી	દાનનો પ્રકાર જળપ્રબંધ દાન
૧૩	શેઠ પ્રેમજીભાઇ હરજીની વિધવા	મુંબઇ	૫૧)	—	,,
૧૪	શેઠ હરિરામભાઈ ગોપાલજી	,,	૫૧)	—	,,
૧૫	શેઠ ખીમજીભાઇ મનજીના ધર્મ-પત્નિ બાઇ વીરબાઇ	શેહરવાલા	૫૧)	—	,,
૧૬	શેઠ ડોસાભાઇ તુલસીદાસ હસ્તે જમનાબાઇ	હમલા	૫૧)	—	,,
૧૭	શેઠ દેવચંદ ધર્મસિંહ સેઠિયા	અંજાર	૨૫)	—	,,
૧૮	શ્રીમાન્ લાલજીભાઇ રવજી ખાંટ	દરસડી	૨૫)	—	,,
૧૯	શેઠ વીરજીભાઇ વિશ્રામ કોઠારી	મંજલ	૨૫)	—	,,
૨૦	શેઠ ગોકુલદાસભાઈ શામજી	કોજાચોરા	૨૫)	—	,,
૨૧	શેઠ હીરજીભાઇ કેશવજી	મુંબઇ	૨૫)	—	,,
૨૨	શેઠ પ્રાગજીભાઇ લીલાધર	,,	૨૫)	—	,,
૨૩	શેઠ શ્રી શામજીભાઇ	,,	૨૫)	—	,,
			૩૫૦૯-૪		
૧	રૂ. ૧૦ થી ઓછી મળેલ રકમ	—	૩૩—૬	—	સામાન્ય દાન
૨	કોરી ૨૫ થી ઓછી મળેલ રકમ	—	—	૭૯)	,,
૩	ભાઇ શ્રી જેરામભાઇ પ્રેમજી	કુકમા	૫૦)	—	ગૌશાળા માટે
૪	શેઠ ઠાકરશીભાઇ પ્રાગજી	—	૨૫)	—	,,
૫	શ્રી હીરજીભાઇ પ્રેમજી	કુકમા	૭૫)	—	,,
૬	શેઠ રતનશીભાઇ હીરજી	વારૂ	—	૨૬૦)	,,
૭	શેઠ રામજીભાઇ નારાણ	મંજલ	—	૧૩૦)	,,
૮	કોજાચોરાના સતિ સેવકો	કોજાચોરા	—	૫૦)	,,
૯	ગામશ્રી કોટડીવાલાના સતિ સેવકો તરફથી	કોટડી	—	૩૩)	,,
૧૦	શેઠ શ્રી વીરજીભાઈ પેરાજ	મસ્કા	—	૮૨)	,,
૧૧	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	—	૨૬૧)	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n29/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂ.	કોરી	દાનનો પ્રકાર ગૌશાળા માટે
૧૨	માતાજી નેણબાઇમા	,,	—	૨૬૧)	ગૌશાળા માટે
૧૩	વેકરાના જાડેજા ગોવિંદજી પાસેથી	વેકરા	—	૨૫)	,,
૧૪	માતાજી પાસેથી	—	—	૨૫)	,,
૧૫	મીસ્ત્રી પ્રેમજીભાઇ એ‍ંગાર	કુકમા	—	૨૬૧)	,,
૧૬	મીસ્ત્રી હીરજીભાઇ વિશ્રામ	હાજાપુર	—	૨૬૧)	,,
૧૭	શ્રી શામજીભાઇ મોરારજી	ધુણી	—	૧૯૫)	,,
૧૮	માતાજી લક્ષ્મીબાઇ	વાંકુ	—	૮૭।।	,,
૧૯	માતાજી લીલબાઇમા	,,	—	૧૭।।	,,
૨૦	માતાજી રાધાબાઇમા	લખપત	—	૧૭૫)	,,
૨૧	માતાજી જાનકીબાઇમા	મોધારા	—	૮૭।।	,,
૨૨	શેઠ શ્રી લક્ષ્મીદાસભાઇ હંશરાજ	ગઢશીસા	—	૩૨।।	,,
૨૩	શેઠ શ્રી લક્ષ્મીદાસભાઇ હંશરાજ	,,	—	૯૬૦)	,,
૨૪	શેઠ શ્રી લક્ષ્મીદાસભાઇ હંશરાજ	,,	—	૧૨૦)	,,
૨૫	માતાજી માણેકમા હસ્તે પૂજ્ય મૈયાજી	મંજલ	—	૫૧)	અન્નદાન
૨૬	શ્રીમાન્ મનજીભાઇ જેરામ	માધાપુર	—	૧૬૮)	,,
૨૭	શેઠ તુલસીદાસ ત્રીકમજી ખાંટ	દરસડી	—	૩૧)	,,
૨૮	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	—	૧૬।।	,,
૨૯	બાઈ લક્ષ્મીબાઇ હસ્તે જેરામભાઈ પ્રેમજી	કુકમા	—	૨૧૯)	,,
૩૦	સ્વ. માણેકબાઇ હસ્તે પૂજ્ય મૈયાજી	મંજલ	—	૫૦)	,,
૩૧	પૂજ્ય સાધ્વી મૈયાજી	,,	—	૩૬।।।	૨।। ,,
૩૨	પૂજ્ય સાધ્વી મૈયાજી	,,	—	૧૭૨।।	૪।। ,,
૩૩	શ્રીમાન્ મનજીભાઇ જેરામ	માધાપુર	—	૧૬૨)	૫।। ,,
૩૪	શ્રી લાલજીભાઇ મૂલજી	નાગોર	—	૪૪૦)	૩ ,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n30/mode/1up

realpatidar.com

સાં. ૧૯૯૭ માં દાન આપનાર દાન-દાતાઓના નામ.

ક્રમ	નામ	સ્થળ	રૂ.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૧	ડા. દામજીભાઇ ભીમજી	કલ્યાણપુર	—	૨૫૧)	,,
૨	નારાણ દેવજીની માતુશ્રી મટુબાઇ	,,	—	૧૦૧)	,,
૩	માતુશ્રી ધનબાઈ	મુંબઇ	—	૧૦૦)	,,
૪	શ્રી જેરામભાઈ પ્રેમજી	કુકમા	—	૫૦)	,,
૫	કોઠારી મણીલાલ કલ્યાણજી	ભુજ	—	૪૦)	,,
૬	એક બહેન	નખત્રાણા	—	૫૧)	,,
૭	બાઇ મોંઘીબાઈ ત્રીકમદાસજી હસ્તે ડૉ. ભાણજીભાઈ	મુંબઇ	—	૭૫)	,,
૮	માતુશ્રી લીલબાઇ	મુંબઈ	૧૦)	—	,,
૯	શ્રી પુરૂષોત્તમભાઇ હીરજી	—	૨૫)	—	,,
૧૦	શેઠ વાસુદેવભાઇ જેઠાભાઈ	મુંબઇ	૧૦૧)	—	,,
૧૧	શ્રી જાદવજીભાઈ રતનશી	,,	૧૫)	—	,,
૧૨	શ્રી ખીમજીભાઇ માધવજી	,,	૧૦)	—	,,
૧૩	શ્રી વિશનજીભાઈ કાનજી	,,	૧૧)	—	,,
૧૪	શ્રી કેશવજીભાઇ મૂલજીની કું.	,,	૧૧)	—	,,
૧૫	શ્રી કાનજીભાઇ મોતીભાઈ	,,	૫૧)	—	,,
૧૬	શ્રી પ્રેમજીભાઇ હરિદાસ	,,	૫૧)	—	,,
૧૭	માતાજી જાનકીબાઇ	,,	૨૫)	—	,,
૧૮	શ્રી કરમસિંહભાઇ ત્રીકમજી	,,	૧૦)	—	,,
૧૯	શ્રી કલ્યાણજીભાઈ તેજપાલ	,,	૧૦)	—	,,
૨૦	શ્રી શામજીભાઇ કલ્યાણજી	,,	૧૦)	—	,,
૨૧	શ્રી કરશનદાસભાઇ કાનજી	,,	૨૫)	—	,,
૨૨	શ્રી દયાળભાઈ ડોસા	,,	૧૫)	—	,,
૨૩	માતાજી રામાબાઇ મોનજી	,,	૫૦)	—	,,
૨૪	શ્રી મોરારજીભાઇ ગાંગજી	,,	૧૦)	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n31/mode/1up

1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂ.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૨૫	શ્રી મીઠુભાઇ ભીમજી	મુંબઇ	૧૫)	—	,,
૨૬	શેઠ તુલસીદાસભાઇ ત્રીકમજી	દરસડી	૧૦)	—	,,
૨૭	શેઠ ખીમજીભાઇ ત્રીકમજી	નખત્રાણા	—	૨૫)	,,
૨૮	શેઠ તુલસીદાસભાઇ ત્રીકમજી	દરસડી	૧૦)	—	,,
૨૯	શેઠ જાદવજીભાઇ પ્રેમજી	મુંબઇ	૧૦)	—	,,
૩૦	કોઠારી મણીલાલભાઇ કલ્યાણજી	ભૂજ	૧૦)	—	,,

: સાં. ૧૯૯૭ ના વાર્ષિક ઉત્સવપર મળેલ દાનની નોંધ :

મિતિ ચૈત્ર સુદ ૯–૧૦–૧૧

૧	મીસ્ત્રી દાનાભાઇ પંચાણ	કુકમા	—	૨૫૧)	,,
૨	શ્રી પરબતભાઇ ગાંગજી રાઠોડ	,,	—	૧૦૧)	,,
૩	શેઠ શુરજીભાઇ વલ્લભદાસ	મુંબઇ	૧૦૦)	—	,,
૪	શેઠ મૂલજીભાઇ સીકકા	,,	૧૦૦)	—	,,
૫	શેઠ પ્રેમજીભાઇ હરિદાસની કું.	,,	૫૧)	—	,,
૬	શેઠ કાનજીભાઇ મોતી પંચાણ	,,	૫૧)	—	,,
૭	શેઠ હરિરામભાઈ ગોપાલજી હસ્તે હરિદાસભાઇ	,,	૨૫)	—	,,
૮	શેઠ મોનજીભાઇ માધવજી હસ્તે કાનજીભાઇ	,,	૨૫)	—	,,
૯	શ્રી મનજીભાઇ જેરામ	માધાપુર	૨૫)	—	,,
૧૦	શેઠ વીરજીભાઈ વિશ્રામ કોઠારી	મંજલ	—	૧૦૧)	,,
૧૧	શેઠ લાલજીભાઇ રવજી ખાંટ	દરસડી	૫૧)	—	,,
૧૨	ડા. પુરૂષોત્તમભાઈ વિઠલદાસ	ભૂજ	—	૨૫)	,,
૧૩	શાહ દેવચંદભાઇ કુંવરજી	દેશલપુર	—	૨૫)	,,
૧૪	શ્રી રૂડાભાઇ દેવરાજ	માધાપુર	—	૨૫)	,,
૧૫	શ્રી ધીરાઉભાઇ ડોસાભાઇ	વાડા	—	૩૫)	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n32/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૧૬	ડા. સામજીભાઇ મોરારજી	ધુરી	૫૬–૪	–	,,
૧૭	શ્રી નાનજીભાઇ ગોવિંદ	હાજાપુર	૫૦)	–	,,
૧૮	મહારાજ ખીમજીભાઇ ભગત ગુરૂ નાનજી ભગત	બિબ્બર	૧૦)	–	,,
૧૯	શ્રી હીરજીભાઇ વિશ્રામ	હાજાપુર	૧૦૦)	–	,,
૨૦	શ્રી એંગારભાઇ રતના	,,	૫૦)	–	,,
૨૧	શ્રી રવજીભાઇ પુરૂષોત્તમ	મુંબઈ	૨૫)	–	,,
૨૨	કચ્છ કડવા પાટીદારભાઇઓ તરફથી	,,	૨૫)	–	,,
૨૩	શ્રી નેણશીભાઈ ગોકુલદાસ	કલ્યાણપુર	૧૦)	–	,,
૨૪	ઉત્સવને રોજે ભાવિક સદ્દગ્રહસ્થો પાસેથી છુટક છુટક દાનમાં મલી	ઇશ્વિરનગર	–	૪૯૨૦।	,,
૨૫	૧૦ રૂપીઆથી ઓછા મળેલા રૂપીઆ	,,	૫૭–૮	–	,,
૨૬	કોરી ૨૫ થી ઓછી મળેલ રકમ	,,	–	૧૦૨)	,,
૨૭	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	–	૩૦।।૩	અન્નદાન
૨૮	પૂજ્ય સાધ્વી મૈયાજી	,,	–	૪૯।।	૨ ,,
૨૯	બાઇ પ્રેમાબાઇ સતસંગ મંડળ હસ્તે મૈયાજી	નખત્રાણા	–	૧૦૧)	,,
૩૦	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	–	૧૯૬।।	૩ ,,
૩૧	શેઠ શામજીભાઇ કરમશી	નાશિક	–	૧૧૨)	,,
૩૨	શ્રી જેરામભાઈ પ્રેમજી	કુકમા	–	૫૯।	,,
૩૩	શેઠ શ્રી કલ્યાણજીભાઇ વિઠલદાસ હસ્તે પૂજ્ય મૈયાજી	મંજલ	–	૧૬૭।।	૫।।
૩૪	શ્રી હરજીભાઇ ગોવિંદજી	વાંકુ	૨૫)	–	,,
૩૫	શ્રી મનજીભાઇ જેરામ રાઠોડ	માધાપુર	–	૨૩૨)	૩ ,,
૩૬	શ્રી મનજીભાઇ જેરામ રાઠોડ	,,	–	૨૦૫૩।	રામનવમીના ઉત્સવપર
૩૭	શ્રી શામજીભાઇ મોરારજી	ધુરી	–	૩૬।।	ભોજન ખર્ચ અન્નદાન.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n33/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂ.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૩૮	ભાઇ શ્રીજાદવજી પ્રેમજી	—	—	૫૦)	સામાન્ય દાન
૩૯	વકીલ શ્રી ગોપાલજીભાઇ ઉમરશી	ભૂજ	—	૧૦૦)	વાર્ષિક દાન
૪૦	ભાઇશ્રી ઉમરશી પ્રાગજી	,,	—	૧૦૦)	,,

: સાં. ૧૯૯૮ માં દાન આપનાર દાન–દાતાઓનાં નામ :

૧	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	—	૧૦૧ાા	સામાન્યદાન
૨	શ્રી દેવસીભાઇ રાજા	નાગોર	—	૨૫૧)	,,
૩	શ્રી માવજીભાઇ જેઠુભાઈ	મોટા રતડીઆ	—	૨૫)	,,
૪	શ્રી રણછોડદાસભાઈ મોનજી	મુંબઈ	૫૦)	—	,,
૫	માતાજી ડાહીબાઇ	કલ્યાણપુર	૧૦)	—	,,
૬	મીસ્ત્રી નાનજીભાઇ ગોવિંદ	હાજાપુર	૨૫)	—	,,
૭	માતાજી મિઠામા સપ્તાહ પ્રસંગે હસ્તે શ્રી દયાળભાઇ	તેરા	—	૧૦૧)	,,
૮	શ્રી દયાળભાઇ જેઠમલ	,,	—	૫૧)	,,
૯	શેઠ નારાણભાઈ પુરૂષોત્તમના ટ્રસ્ટના શ્રીમાન્ ટ્રસ્ટીઓ તરફથી હસ્તે શ્રીમાન્ શેઠ શરજી વલ્લભદાસ	મુંબઇ	૬૦૦)	—	,,
૧૦	શ્રી મનજીભાઇ જેરામ	માધાપુર	૨૫)	—	,,
૧૧	શ્રી ભોજાભાઈ નાથા	કુકમા	૧૧)	—	,,
૧૨	શ્રી ગોકુલદાસભાઈ શામજી	મુંબઇ	૨૫)	—	,,
૧૩	શ્રી પ્રાગજીભાઇ લધા	,,	૧૦)	—	,,
૧૪	શ્રી દામજીભાઈ શીવજી	,,	૨૫)	—	,,
૧૫	શ્રી નાનજીભાઇ હમીરભાઇ	,,	૧૦)	—	,,
૧૬	શ્રી શામજીભાઈ મોરારજી	,,	૨૫–૪	—	,,
૧૭	આઝાદ લાલે	,,	૧૧)	—	,,
૧૮	શ્રી ભીમજીભાઇ વાલજી	,,	૧૧)	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n34/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૧૯	શ્રી દયાળભાઇ નારાણ	,,	૧૧)	—	,,
૨૦	શ્રી લાલજીભાઇ હીરજીભાઇ	,,	૧૧)	—	,,
૨૧	શ્રી ઠાકરસિંહભાઇ નરસિંહભાઈ	,,	૧૧)	—	,,
૨૨	શ્રી ભીમજીભાઇ રતનશી રૂપારેલ	,,	૧૧)	—	,,
૨૩	કચ્છ લોહાણા સહકારી મંડળ	માટુંગા	૨૫)	—	,,
૨૪	શ્રી લાલજીભાઇ જેઠાભાઇ હસ્તે શ્રી દેવજીભાઇ લાલજીભાઇ	,,	૧૧)	—	,,
૨૫	શ્રી ગાંગજીભાઇ કાનજીભાઇ હસ્તે શ્રી વિઠલદાસભાઇ	,,	૧૧)	—	,,
૨૬	શ્રી પ્રેમજીભાઈ હરિદાસની કું.	,,	૧૦૧)	—	,,
૨૭	શ્રી દયાળભાઈ ડોસાભાઇ	,,	૩૦–૪	—	,,
૨૮	શ્રી લક્ષ્મીદાસભાઇ મેઘજીભાઇ	,,	૫૧)	—	,,
૨૯	શ્રી માવજીભાઇ જેઠાભાઇ	સાડીઆ વાલા	૨૫–૪	—	,,
૩૦	શ્રી જાદવજીભાઇ રતનશીભાઇ	મુંબઈ	૨૫–૪	—	,,
૩૧	શ્રી કરમશીભાઇ ત્રીકમજી	જખૌ	૧૦)	—	,,
૩૨	શ્રી કલ્યાણજીભાઇ તેજપાલ	,,	૧૫)	—	,,
૩૩	શ્રી મોરારજીભાઈ ગાંગજી	બિટિયારી	૧૦)	—	,,
૩૪	શ્રી મીઠુભાઇ ભીમજી	,,	૧૫)	—	,,
૩૫	શ્રી હેમરાજભાઇ પુરૂષોત્તમ	અઇડા	૧૦)	—	,,
૩૬	માતાજી રાધાબાઇ	મુંબઈ	૨૫)	—	,,
૩૭	શ્રી પુરૂષોત્તમભાઇ હીરજીની ધર્મપત્નિ લક્ષ્મીબાઇ	,,	૨૫)	—	,,
૩૮	શેઠ શ્રી પ્રેમજીભાઇ હરિદાસ હસ્તે શ્રી જેઠાભાઇ	,,	૧૫)	—	,,
૩૯	શ્રી રવજીભાઇ પુરૂષોત્તમ	,,	૧૧)	—	,,
૪૦	શ્રી કેશવજીભાઈ વાઘજીની કું.	,,	૨૫)	—	,,
૪૧	શેઠ શ્રી શરજી વલ્લભદાસ	,,	૧૦૧)	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n35/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૪૨	શ્રી કાનજીભાઇ મોતીભાઇ પંચાણ	મુંબઇ	૧૦૦)	—	,,
૪૩	માતાજી મમીબાઇ	,,	૨૫)	—	,,
૪૪	શ્રી હરિરામભાઇ ગોપાલજી	,,	૨૫)	—	,,
૪૫	શેઠ દયાળભાઇ જેઠમલ	,,	૧૦)	—	,,
૪૬	શેઠ શ્રી હરિદાસભાઇ વેલજી દિવાળીના ભેટના બ્રહ્મચારીઓને	,,	૧૪)	—	,,
૪૭	દુધરેજના મહંત શ્રી ગોમતીપ્રસાદ	દુધરેજ	૧૦)	—	,,
૪૮	પાટીદાર રતનશીભાઇ ખીમજી	મુંબઇ	૨૫–૪	—	,,
૪૯	શ્રી હેમચંદભાઈ મકનજી	,,	૨૫)	—	,,
૫૦	શ્રી કરશનભાઇ ઉકેડા	,,	૧૦)	—	,,
૫૧	શ્રી રતનશીભાઇ પંચાણ	રેહા	૨૫)	—	,,
૫૨	શ્રી કુંવરજીભાઇ ગોપાલ	ગોંદીઆ	૧૦)	—	,,
૫૩	શ્રી અરજણભાઇ લાલજી	માધાપુર	૧૫)	—	,,
૫૪	શ્રી લધારામભાઇ ખીમજી	ખંભરા	૨૦)	—	,,
૫૫	શ્રી જેરામભાઇ શીવજી	જલેશ્વર	૫૦)	—	,,
૫૬	શ્રી રૂડાભાઈ કલ્યાણજી	,,	૧૧)	—	,,
૫૭	શ્રી નાનજીભાઈ ગોવિંદ	હાજાપુર	૫૧)	—	,,
૫૮	શ્રી ડાહ્યાભાઇ મનજી રાઠોડ	માધાપુર	૧૦૦)	—	,,
૫૯	શ્રી કરશનદાસભાઇ કાનજી	નળીઆ	૨૫)	—	વાર્ષિક સભ્ય
૬૦	શેઠ શ્રી તુલશીદાસભાઇ ત્રીકમજી	દરશડી	—	૫૧	સામાન્ય દાન
૬૧	કોટન એશોસિએશન	મુંબઇ	૧૦૦)	—	,,
૬૨	ભાનુ જાદવજીભાઇ રતનશી	,,	૨૦)	—	,,
૬૩	ધી ગ્રેન મરચન્ટ એસોશિએશન હસ્તે શ્રી પ્રેમજી હરિદાસ	,,	૫૦૦)	—	,,

realpatidar.com

realpatidar.com

: ઉત્સવ પ્રસંગે મળેલ દાન. :

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૧	શ્રીમાન્ મનજીભાઇ જેરામ	માધાપુર	—	૧૦૦૬।।૪।।	,,
૨	શ્રી કરશનભાઇ વિશ્રામ હસ્તે તેમના પત્નિ મોંઘીબાઈ	નાગોર	—	૫૦૦)	,,
૩	શ્રી માંડણભાઇ ભાણજી પરમાર	કુકમા	—	૨૫)	,,
૪	માતાજી મમીબાઈ	કોટડા	—	૫૧)	,,
૫	વકીલ શ્રી ગોપાલજીભાઈ ઉમરશી	ભૂજ	—	૨૦૦)	,,
૬	શ્રી વાલજીભાઇ રતના	માધાપુર	—	૨૫)	
૭	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	—	૧૦૧)	,,
૮	માતાજી નેણબાઇમા	,,	—	૧૦૧)	,,
૯	રાણીબાઈ	,,	—	૧૦૧)	,,
૧૦	મઠુબાઇ	દેવીપર	—	૧૦૧)	,,
૧૧	ભચીબાઈ કોઠારી	નખત્રાણા	—	૧૦૧)	,,
૧૨	શ્રી વીરજીભાઇ વિશ્રામ કોઠારી	મંજલ	—	૫૧)	,,
૧૩	શ્રી દેવચંદભાઈ કુંવરજી	દેસલપુર	—	૨૫)	,,
૧૪	પરચુરણ	મંજલ	—	૨૬)	,,
૧૫	અંજાર સોરઠીભાઇઓના સંઘ તરફથી	અંજાર	—	૧૦૧)	,,
૧૬	શ્રી હંશરાજભાઈ માધવજી	ગઢશીસા	—	૨૫)	,,
૧૭	શ્રી શામજીભાઈ માધવજી	,,	—	૨૫)	,,
૧૮	શ્રી કરશનદાસભાઇ કાનજી	નળીઆ	—	૨૫)	,,
૧૯	શ્રી ખેંગારભાઇ રતના	હાજાપુર	—	૧૦૧)	,,
૨૦	શ્રી રતનશીભાઇ પંચાણ	કુકમા	—	૨૫।	,,
૨૧	શેઠ શ્રી પ્રધાનભાઇ પુંજા	દેસલપુર	—	૨૫)	,,
૨૨	બાઇ ભાણીમા	માધાપુર	—	૨૫)	,,
૨૩	શ્રી ગોવિંદભાઇ લખધીરજી	વેકરા	—	૫૦)	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n37/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૨૪	શ્રી શીવા ભગત	રતનાર	—	૨૬)	,,
૨૫	શાહ મોતીચંદભાઇ રણછોડદાસ	અંજાર	—	૫૧)	,,
૨૬	સોની કાનજીભાઈ પ્રેમજી	,,	—	૫૧)	,,
૨૭	બ્રહ્મચારીની ઝોળીમા	ઈશ્વિરનગર	—	૫૭ાાર	,,
૨૮	ગઢશીસાના પાટીદાર ભાઈઓ હસ્તે મુખી હરજીભાઈ ખેતા તરફથી	ગઢશીશા	—	૨૦૧)	,,
૨૯	ગામ લોડવાના પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે પટેલ રવજીભાઇ લાલજી	લોડવા	—	૧૨૫ા	,,
૩૦	ગામ નખત્રાણા પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે શ્રી નથુભાઇ નાનજી	નખત્રાણા	—	૧૨૫)	,,
૩૧	ગામ વેસપુરના પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે શ્રી કાનજીભાઇ નથુ	વેસલપુર	—	૮૦)	,,
૩૨	ગામ તલવાણાના પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે શ્રી રતનશીભાઈ કાનજી અને શ્રી શીવજીભાઇ માધવજી	તલવાણા	—	૪૦)	,,
૩૩	ખાંડપરના પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે શ્રી શીવજીભાઇ ભાણજી	ખાંડપર	—	૪૦)	,,
૩૪	માનકુવાના પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે શ્રી રાજારામભાઈ તથા શ્રી જીવરામભાઇ	માનકુવા	—	૪૦)	,,
૩૫	ગામ કોટડાના પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે શ્રી લધાભાઇ	કોટડા જડોતર	—	૫૯ાા	,,
૩૬	વીરાણીના પાટીદાર ભાઈઓ તરફથી	વીરાણી ગઢવાડી	—	૩૧)	,,
૩૭	શ્રી પાટીદાર વાલજીભાઇ ગોપાલ	વીરાણી મોટી	—	૩૦)	,,
૩૮	સુરતમાં રહેતા પાટીદાર ભાઈઓ તરફથી હસ્તેભાઈ જીવરાજ હીરજી	સુરતમથલ	૪૪)	—	,,
૩૯	ડા. મણીલાલભાઈ કલ્યાણજી કોઠારી	મંજલ	૨૦)	—	,,
૪૦	શ્રી દાનાભાઈ પંચાણ	કુકમા	૫૦)	—	,,
૪૧	શ્રી પ્રાગજીભાઈ નાનજી	,,	૧૦)	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n38/mode/1up

1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૪૨	ભાનુ. જાદવજીભાઇ રતનશી	જખૌ	૧૫)	—	,,
૪૩	મહારાજ શ્રી રવજીભાઇ	બિબ્બર	૧૦)	—	,,
૪૪	ભગત ખીમજીભાઇ ગુરુ કાનજીભાઇ	,,	૧૦)	—	,,
૪૫	શારદાપુર કંપા તરફથી (પાટીદાર) હસ્તે શ્રી ધનજીભાઇ રાજા	ગુજરાત	૨૨)	—	,,
૪૬	શેડી કંપાના પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે શ્રી નારાણભાઇ કાનજી	,,	૨૪)	—	,,
૪૭	મરોડ કંપાના પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે શ્રી કાનજીભાઇ માધવજી	,,	૨૦)	—	,,
૪૮	એદલપર કંપાના પાટીદાર ભાઇઓ તરફથી હસ્તે શ્રી મૂલજીભાઇ પ્રેમજી	,,	૧૦)	—	,,
૪૯	પાટીદાર ભાઇઓ તરફથી પરચુરણ	—	૧૧–૪	—	,,
૫૦	મુંબઇના એક ગૃહસ્થ તરફથી	મુંબઈ	૩૦)	—	,,
૫૧	શ્રી માવજીભાઇ હીરજી	વીડી	૧૧)	—	,,
૫૨	મીસ્ત્રી શ્રી હરભમભાઈ વાલજી	કુકમા	૨૫)	—	,,
૫૩	શ્રી છગનલાલભાઇ કલ્યાણજી	કોઠારા	૨૦)	—	,,
૫૪	શ્રી ભીમજીભાઈ	વિઝાંણ	—	૨૫)	,,
૫૫	શ્રી માંડણભાઈ ભાણજી પરમાર	કુકમા	૧૦૦)	—	,,

: સંસ્થાની ઝોડી લઇ જતાં મુંબઇમાં મળેલ દાન :

૧	શેઠ શ્રી પ્રેમજીભાઇ હરિદાસ	મુંબઈ	૨૫૦)	—	,,
૨	શ્રી કાનજીભાઇ જાદવજીની કું.	,,	૧૦૧)	—	,,
૩	માતાજી લીલબાઇમા	,,	૧૦૦)	—	,,
૪	શ્રી કાનજીભાઇ મોતીભાઇ પંચાણ	,,	૫૧)	—	,,
૫	શ્રી નેણસીભાઇ તેજપાલ	,,	૨૫–૪	—	,,
૬	શ્રી વલમજીભાઇ નારાણ	,,	૨૫–૪	—	,,
૭	શ્રી નરસિંહભાઇ નાનજી	,,	૨૫–૪	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n39/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૮	શ્રી ચુનિલાલભાઈ પ્રાણજીવન	મુંબઇ	૨૫-૪	—	,,
૯	શ્રી દામજીભાઈ શીવજી	,,	૨૫)	—	,,
૧૦	શ્રી વિશ્રામભાઇ નરસિંહ	,,	૨૫)	—	,,
૧૧	શ્રી રતનશીભાઇ ખેરાજ	,,	૨૫)	—	,,
૧૨	શ્રી ઠાકરશીભાઇ નરસિંહ	,,	૨૫)	—	,,
૧૩	શ્રી મોરારજીભાઈ કરશનદાસ	,,	૨૫)	—	,,
૧૪	શ્રી ઓધવજીભાઇ ભીમજી	,,	૨૫)	—	,,
૧૫	શીક વેરા એન્ડ સન્સ	,,	૨૧)	—	,,
૧૬	શ્રી મીઠુભાઈ ભીમજી	,,	૧૫)	—	,,
૧૭	શ્રી રાયસિંહભાઇ જીવરાજ	,,	૧૫-૪	—	,,
૧૮	માતાજી લીલબાઇમા	,,	૨૦)	—	,,
૧૯	માતાજી રાધાબાઇમા	,,	૨૧)	—	,,
૨૦	માતાજી જાનકીબાઇમા	,,	૧૦)	—	,,
૨૧	શ્રી પુરૂષોત્તમભાઇ રણછોડ	,,	૧૦-૪	—	,,
૨૨	શ્રી દેવજીભાઇ નારાણ	,,	૧૦-૪	—	,,
૨૩	માતાજી મમીબાઇમા	,,	૧૦)	—	,,
૨૪	શ્રી અર્જુનભાઇ બુદ્ધીધન	,,	૧૧)	—	,,
૨૫	શ્રી કેશવજીભાઇ મૂલજીની કું.	,,	૧૧)	—	,,
૨૬	શ્રી કેશવજીભાઇ ચાગપાડ	,,	૧૧)	—	,,
૨૭	શ્રી જાદવજીભાઇ પ્રેમચંદ	,,	૧૧)	—	,,
૨૮	શ્રી જાદવજીભાઇ હરિરામના ધર્મપત્નિ	,,	૧૦)	—	,,
૨૯	શ્રી દામજીભાઇ કાનજી	,,	૧૧)	—	,,
૩૦	શ્રી ધર્મસિંહભાઇ ભવાનજી	,,	૧૦)	—	,,
૩૧	શ્રી ભીમજીભાઈ રતનશી રૂપારેલ	,,	૧૧)	—	,,
૩૨	શ્રી મથુરદાસભાઇ મોનજી	,,	૧૧)	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n40/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૩૩	શ્રી નારાણભાઈ ખટાઉ	મુંબઇ	૧૦)	—	,,
૩૪	શ્રી કેશવજી વાઘજીની કું.	,,	૧૧)	—	,,
૩૫	સેન દયાળની કું.	,,	૧૧)	—	,,
૩૬	શ્રી કુંવરજી ડુંગરશીની કું.	,,	૧૧)	—	,,
૩૭	શ્રી દામજીભાઈ હીરજી	,,	૧૧)	—	,,
૩૮	શ્રી રણછોડભાઇ મેઘજી	,,	૧૦)	—	,,
૩૯	એક બાઇ તરફથી	,,	૧૦)	—	,,
૪૦	મુલુનમાં ભાઈઓ તથા બહેનો તરફથી	,,	૨૪)	—	,,
૪૧	શ્રી લક્ષ્મીબાઇ ગુંદાડાવાલા	,,	૬૦)	—	,,
૪૨	શ્રી નારાણભાઇ હસ્તક	,,	૧૪)	—	,,
૪૩	શેઠ શૂરજીભાઇ ઉમરશી	ભૂજ	૧૭)	—	,,
૪૪	શ્રી દાનાભાઈ પંચાણ પરમાર	કુકમા	—	૨૫)	,,
૪૫	શેઠ શ્રી પ્રેમજીભાઇ હરિદાસની કું.	મુંબઇ	૧૦૦)	—	,,
૪૬	શ્રી વિશ્રામભાઇ ત્રીકમજી હસ્તે ભાઈ માંડણભાઈ ભાણજી	રેહા	૫૦૦)	—	,,
૪૭	ધી શીડસ ટ્રેડસ એશોસિએશન	મુંબઈ	૧૦૧)	—	,,
૪૮	પૂજ્ય શ્રી સાધ્વી મૈયાજી	મંજલ	—	૧૦૧ાા	,,
૪૯	૧૦ રૂપીઆથી ઓછી મળેલ રકમ	—	૪૩૬–૬	—	,,
૫૦	કોરી ૨૫ થી ઓછી મળેલ રકમ	—	—	૬૮૭ા	,,
૫૧	શ્રી હીરજીભાઇ વિશ્રામ	હાજાપુર	—	૨૧૧)	અન્નદાન
૫૨	માતાજી જમનાબાઇ	મુંબઈ	૫૦)	—	,,
૫૩	માતાજી રાધાબાઇ	,,	૨૫)	—	,,
૫૪	શ્રી મણીલાલભાઈ કલ્યાણજી	મંજલ	૨૦)	—	,,
૫૫	શ્રી ખીમજીભાઈ વીરજી ઠક્કર	આરીખાન	૧૧)	—	,,
૫૬	શ્રી વીરજીભાઇ પેરાજ	મુંબઇ	૧૦૦)	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n41/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર અન્નદાન
૫૭	શેઠ શ્રી વેલજીભાઇ નરસિંહ હસ્તે છગનલાલભાઈ	ગોધરા	—	૭૨)	,,
૫૮	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	—	૭૨ાા૧ાા	,,
૫૯	શ્રી હરિરામભાઈ પારપૈયા	નખત્રાણા	—	૭૩ા૩	,,
૬૦	શેઠ શ્રી પ્રેમજીભાઇ હરિદાસની કું.	મુંબઇ	૨૫૦)	—	,,
૬૧	શેઠ શ્રીવજીભાઇ અરજણ	ધુણી	૧૦)	—	,,
૬૨	શ્રી મનજીભાઇ જેરામ	માધાપુર	—	૭૫ા	,,
૬૩	પૂજ્ય માતાજી આગબાઇમા	ઇશ્વરનગર	—	૯૧)	,,
૬૪	શેઠ પુરૂષોત્તમ હીરજીના ધર્મપત્નિ લક્ષ્મીબાઇ	મુંબઇ	૫૦)	—	,,
૬૫	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	૫૦)	—	,,
૬૬	શેઠ નાનજીભાઇ દેવજી	સાયરા	—	૩૦)	,,
૬૭	માતાજી નેણબાઇમા	મંજલ	—	૧૬૧-૩ાા	,,
૬૮	શેઠ શ્રી કલ્યાણજીભાઇ વિઠલદાસ જસાણી	,,	૫૦)	—	,,
૬૯	માતુ શ્રી બાજીરાજ બા સાહેબ	દેપર જાગીર	—	૪૧)	,,
૭૦	પૂજ્ય સાધ્વી મૈયાજી	મંજલ	૨૫)	—	જન્માષ્ટમીના ફળહાર માટે
૭૧	શ્રી શીવજીભાઇ	અંજાર	—	૧૦૦)	ગૌદાન
૭૨	ભાઇ શ્રી નારાણભાઈ રાઘવજીના પુત્ર વલભદાસ તરફથી	,,	—	૮૦)	,,
૭૩	બાઇ વીરબાઇના માતુ શ્રી મૂલબાઇ	—	—	૮૦)	,,

: સં. ૧૯૯૯ માં દાન આપનાર દાન દાતાઓનાં નામ :

૧	પૂજ્ય મહારાજ શ્રી ઉદ્ધવરામજી	ઇશ્વરનગર	—	૮૦	ભોજનદાન
૨	પટેલ કરમશીભાઇ ત્રીકમજી	જખૌ	૧૦)	—	સામાન્ય દાન
૩	ભા. કલ્યાણજી તેજપાળ	જખૌ	૧૦)	—	,,
૪	ભા. રવજીભાઇ કરમશી	જખૌ	૬	—	,,

realpatidar.com

https://archive.org/details/bk785/page/n42/mode/1up

realpatidar.com

ક્રમ	નામ	સ્થળ	રૂા.	કોરી	દાનનો પ્રકાર સામાન્ય દાન
૫	ભા. લક્ષ્મીદાસભાઇ મેઘજી	જખૌ	૧૦	—	,,
૬	ભા. જેરામભાઇ વેલજી	બિટીયારી	૧૦	—	,,
૭	ભા. જાદવજીભાઇ રતનશી	જખૌ	૨૦	—	,,
૮	ભા. મોરારજી ગાંગજી	બિટીયારી	૧૦	—	,,
૯	શેઠ શાહ હરખચંદ મકનજી	મુંબઇ	૨૫	—	,,
૧૦	સાધ્વી કલ્યાણબાઇમા	ગઢસીસા	—	૩૨	,,
૧૧	કો. ૨૫ થી ઓછી મળેલી રકમ	—	—	૨૦	,,
૧૨	રૂ. ૧૦ થી ઓછી મળેલી રકમ	—	૨	—	,,

— શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળની —
સંક્ષિપ્ત નિયમાવલિ

ઉપોદ્‌ઘાતઃ—

યત : શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ વિદ્યાલયના સંચાલન માટે નીચેના નિયમ બનાવવામાં આવ્યા છે.

(૧) પરિભાષાઃ—

ગુરૂકુળને શિક્ષણાલયનું નામ છે જેમાં બાળકો જેમનો યથોચિત ઉપનયન તથા વેદારંભ સંસ્કાર થઇ ચૂકયો હોય તે શિક્ષણ અને કેળવણી પ્રાપ્ત કરે.

(૨) નામઃ—

આ સંસ્થાનું નામ પ્રાત: સ્મરણિય પૂજ્યપાદ બ્રહ્મનિષ્ઠ શ્રી ઇશ્વરરામજી મહારાજના સ્મારક રૂપે "ઇશ્વરરામજી ગુરૂકુળ વિદ્યાલય" રહેશે.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n43/mode/1up

realpatidar.com

(૩) પઠન પાઠનઃ-

આ ગુરૂકુળમાં વિદ્યાર્થીઓને બ્રહ્મચારી રહીને નિમ્ન લિખિત શિક્ષણ મેળવવું પડશે.

(૧) સત શાસ્ત્ર તથા આધુનિક આવશ્યક વિદ્યા
(૨) સંસ્કૃત ભાષા તથા સંસ્કૃત સાહિત્ય.
(૩) ગૂજરાતી ભાષા તથા ગૂજરાતી સાહિત્ય.
(૪) હિંદી રાષ્ટ્રભાષા અને સાહિત્ય.
(૫) અંગ્રેજી રાજભાષા
(૬) કોઈપણ પ્રકારનું ખેતી અને હુન્નર ઉદ્યોગનું શિક્ષણ.
(૭) ગીતા, રામાયણ, મહાભારત, ઉપનિષદ્ આદિ ધાર્મિક ગ્રંથોનું શિક્ષણ

સૂચનઃ-શિક્ષણનું માધ્યમ વાતાવરણ ગૂજરાતી ભાષાનું રહેશે.

(૪) વ્યાયામ તથા નિત્ય કર્મઃ-

વ્યાયામ, પ્રાણાયામ, સંધ્યોપાસના, અગ્નિહોત્ર, ઉપનિષદ્, પાઠ, વેદપાઠ, સંકીર્તન, વિગેરે વિદ્યાર્થીઓનાં શિક્ષણનું એક જરૂરી અંગ રહેશે.

(૫) શિલ્પ તથા ઔદ્યૌગિક શિક્ષણઃ-

શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ વિદ્યાલયમાં દરેક વિદ્યાર્થીને હાથ ઉદ્યોગનું શિક્ષણ ફરજીઆત આપવામા આવશે. અને આ શિક્ષણને બૌધિક શિક્ષણ કરતાં ઓછું મહત્વ આપવામાં નહિ આવે.

(૬) ગુરૂકુળમાંઃ-

સર્વ સાધારણ પ્રબંધને માટે મુખ્યાધિષ્ઠાતા છે. અને શિક્ષણના નિરીક્ષણ અને નિમંત્રણ પૂર્ણ પ્રબંધને માટે એક આચાર્યની નિમણુંક પ્રમુખ કે મંત્રી દ્વારા કરવામાં આવશે.

(૭) અધ્યાપકઃ-

ગુરૂકુળમાં સદાચારી, ભાવનાશીલ, ધાર્મિકવૃત્તિવાલા તથા ઉદ્યોગ પરાયણ અધ્યાપકો નીમવામાં આવશે.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n44/mode/1up

realpatidar.com

(૮) પ્રબંધ પ્રવેશાર્થ નિયમઃ-

એવા બ્રહ્મચારીઓને દાખલ કરવામાં આવશે જેમનો યથોચિત રીતે ઉપનયન તથા વેદારંભ સંસ્કાર થઈ ચૂકયો હશે. પરંતુ નિમ્ન લિખિત સરતો પુરતી જરૂરી છે.

क આયુઃ-વિદ્યાર્થીની આયુ દાખલ થતી વખતે ૯ વરસ કરતાં ઓછી કે ૧૧ વરસ કરતાં વધારે ન હોવી જોઈએ જો અગિયાર વરસ કરતાં વધારે હશે તો પ્રમુખ તથા મંત્રીની સંમતિની ખાસ જરૂરિયાત રહેશે.

ख સ્વાસ્થઃ-બ્રહ્મચારીની શારીરિક તથા માનસિક અવસ્થા સારી હોવી જોઈએ.

ग બ્રહ્મચર્યઃ-પરણેલ સખસને વિદ્યાર્થી તરીકે દાખલ કરી શકાશે નહિ. પરંતુ પાટીદાર જ્ઞાતિને આ નિયમ લાગુ થઇ શકશે નહિ.

घ જો બાળકની આયુષ્ય અગિયાર વરસ સુધીની હોય તો પ્રાર્થના પત્ર મુખ્યાધિષ્ઠાતા, શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ. ઇશ્વરનગર (કચ્છ) પો. સદ્દનવાડી એ સરનામે મોકલવો, જેમાં સ્વીકાર અસ્વીકારનો અધિકાર મુખ્યાધિષ્ઠાતાનો છે. અને તેમનો નિર્ણય છેવટનો ગણાશે અગિયાર વરસ કરતાં વધુ ઉમરના વિદ્યાર્થીની અરજી પ્રમુખ કે મંત્રીના નામ પર કરવી.

ङ દાખલ થતી વખતે હરેક વિદ્યાર્થીની શારીરિક, માનસિક, સ્થિતિની પરીક્ષા મુખ્યાધિષ્ઠાતા અને આચાર્ય બંને મળીને કરશે

च બાળકના માતાપિતા અથવા સંરક્ષકે પ્રાર્થનાપત્ર ભરીને મુખ્યાધિષ્ઠાતા પાસે મોકલવો અને તેમના તરફથી સૂચના મળતાં નિયત્ તિથિએ બાળકને લઇને ગુરૂકુળમાં આવવાનું રહેશે.

छ રોગીઃ-શારીરિક ખોડખાંપણ કે જેનામાં વારસામાં આવતા રોગનો સંભવ હોય તેવા બાળકોને ગુરૂકુળમાં દાખલ કરી શકાશે નહિ.

(૯) દાખલ થવાઃ-આવનાર બાળકની છેવટની ચૂંટણી નિમ્ન પ્રકારે થશે. નિમ્ન સંખ્યા કરતાં જો પ્રાવેશિક પરીક્ષામાં વધુ બાળકો ઉત્તીર્ણ થયા

realpatidar.com

https://archive.org/details/bk785/page/n45/mode/1up

realpatidar.com

હશે તો દરેક બાળકનો યોગ્યતા ક્રમ ધ્યાનમાં રાખીને નિયત સંખ્યામાંજ બાળકોને દાખલ કરવાનો અધિકાર સંરક્ષક સમિતિનો રહેશે.

(૧૦) પ્રાર્થનાપત્રોના ના મંજુરીના કારણો જણાવવામાં આવશે નહિ.

(૧૧) ગુરૂકુળનું વરસ:-

क ગુરૂકુળનું વરસ બે સત્રનું રહેશે

ख સત્રનો પ્રારંભ ચૈત્ર શુદ ૧ તથા કાર્તક શુદ ૧ થી થશે.

ग દાખલ થવાની અરજી મહા શુદ ૧૫ સુધી આવવી જોઇએ.

(૧૨) રજાઓ:-

क દર વરસે વિદ્યાલય યોગ્ય સમયે એક માસ બંધ કરવામાં આવશે.

ख એક વરસમાં બે માસથી લાંબી રજા પાળી શકાશે નહિ. વિશેષ અવસ્થામાં આ નિયમમાં ફેરફાર કરવા પ્રમુખ, મંત્રી અને મુખ્યાધિષ્ઠાતાને આસતા રહેશે.

ग રજામાં ગુરૂકુળનાં બ્રહ્મચારીઓને સમયાનુસાર પ્રવાસમાં લઇ જવામાં આવશે પ્રવાસનો પ્રબંધ મુખ્યાધિષ્ઠાતા દ્વારા કરવામાં આવશે.

घ લાંબી રજાઓમાં બ્રહ્મચારીઓને તેમના ઘરે જવા દેવા કે કેમ તે બાબતની મુખત્યારી મુખ્યાધિષ્ઠાતા તથા આચાર્યની છે.

(૧૩) રજાનો પ્રતિબંધ:-

નીચે જણાવેલા ખાસ કારણો સિવાય કોઇપણ બ્રહ્મચારીને ગુરૂકુળમાંથી બહાર જવાની રજા મળશે નહિ.

(૧) બ્રહ્મચારીને કઠિન રોગ થયો હોય

(૨) તેના વાલી અસાધ્ય રોગથી પીડાતા હોય.

(૩) નિકટ સંબંધી ભયંકર માંદગીમાં હોય.

(૪) ગરમીની રજા સિવાય બીજા યા ત્રીજા કારણને લીધે મુખ્યાધિષ્ઠાતા બ્રહ્મચારીને પંદર દિવસથી વધુ રજા અપાશે નહિ.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n46/mode/1up

realpatidar.com

(૧૪) રજાઓમાં:-

બ્રહ્મચારીઓને ઘેર લઇ જવા તથા લાવવાનો બધો ખર્ચ બ્રહ્મચારીના વાલીને શીરે રહેશે.

(૧૫) વાલી અથવા વાલીના અન્ય સંબંધી પોતાના બ્રહ્મચારીને મુખ્યાધિષ્ઠાતા અથવા આચાર્યની રજા મેળવી ગુરૂકુળ ભૂમિમાં મળી શકશે.

(૧૬) પત્રવહેવાર:-

બ્રહ્મચારી પોતાના વાલી સાથે આચાર્ય કે મુખ્યાધિષ્ઠાતાની આજ્ઞા સિવાય પત્રવહેવાર કરી શકશે નહિ. અને આ પત્રવહેવાર મુખ્યાધિષ્ઠાતા કે આચાર્ય દ્વારાજ કરવામાં આવશે.

(૧૭) જે વિદ્યાર્થી તેના વર્ગમાં વિદ્યાભ્યાસ ચાલવાને અસમર્થ રહેશે તેને રજા આપવામાં આવશે જે બ્રહ્મચારી અથવા તેના વાલી પ્રવેશ પત્રની કોઇ પ્રતિજ્ઞા અથવા ગુરૂકુળના કોઈ નિયમનો ભંગ કરશે તો બ્રહ્મચારીને કુલભૂમિમાંથી રજા આપવામાં આવશે.

(૧૮) સંસ્થામાં દાખલ થતા બ્રહ્મચારીઓને તેમના વાલીઓ તરફથી કોઇપણ વસ્તુ કે નાણા આપી શકાશે નહિ.

(૧૯) સમાન વર્તન:-

બ્રહ્મચારીઓની આરોગ્ય તથા શારીરિક અવસ્થા પર વિચાર કરીને ભોજન વસ્ત્ર, સહવાસ આદિમાં બધા બ્રહ્મચારીઓ સાથે ઠીકઠીક સમાન રીતિથી વર્તાવ કરવામાં આવશે.

(૨૦) ભોજ્ય પદાર્થ:-

બ્રહ્મચારીને સાત્વિક તથા પૌષ્ટિક ભોજન આપવામાં આવશે જેમાં વિર્યનાશક, રોગકારી, તામસ (તિક્તસાર કે અતિ લવણ) વિગેરે પદાર્થોનો અતિ વપરાશ કરવામાં આવશે નહિ.

હંમેશાં ભોજનનું નિરીક્ષણ આચાર્ય કે મુખ્યાધિષ્ઠાતા કરશે બ્રહ્મચારીઓના સ્વાસ્થને લક્ષમાં રાખીને ઋતુ, દેશ અને કાળ અનુસાર ભોજનમાં સમયોચિત ફેરફાર કરી શકાશે.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n47/mode/1up

realpatidar.com

(૨૧) વસ્ત્રો:-

क બનતાં સુધી દરેક ઋતુઓને અનુસરીને બ્રહ્મચારીને ખપ પૂરતા ખાદીનાં વસ્ત્રો આપવાની તેમના વાલીની જવાબદારી છે.

ख કપડામાં સંખ્યા અને પ્રકાર મુખ્યાધિષ્ઠાતા નક્કી કરશે.

ग ઉદ્દેશ્યો અને નીતિને બાધ ન કરતા હોય તેવા ફેરફાર મુખ્યાધિષ્ઠાતા કરી શકશે.

(૨૨) પાઠ વિધિ:-

क પાઠ વિધિનો નિશ્ચય આચાર્ય કે મુખ્યાધિષ્ઠાતા નક્કી કરશે

ख સત્રના મધ્યમાં કોઇ પુસ્તક નમળવાને કે એના અનિવાર્ય કારણસર પાઠવિધિમાં સંસ્થાના ઉદ્દેશ્યોને બાધકર્તા ન હોય તેવા રૂપનો ફેરફાર આચાર્ય મુખ્યાધિષ્ઠાતાની સંમતિ લઇને કરી શકશે.

(૨૩) નિઃ શુલ્ક શિક્ષણ:-

આ ગુરૂકુળમાં નિઃ શુલ્ક શિક્ષણ આપવામાં આવે છે વિદ્યાર્થીના શુલ્ક તરીકે કશી પણ રકમ લેવામાં આવતી નથી. ગુરૂકુળને પોષણ બદલ માસિક કોરી ૪૦) ચાલીસ ખર્ચ આવે છે.

(૨૪) દાનદાતાઓનો અધિકાર:-

(૧) બાળકોનાં માતાપિતા અને સંરક્ષકો અગર તો ઇતર જનતા તરફથી મળતું દરેક પ્રકારનું દાન ધનધાન્ય કે વસ્ત્રો સાભાર સ્વીકારવામાં આવશે અને તે ગુરૂકુળના ચોપડે જમા થશે.

(૨) મકાન બાંધવા માટે કે શિષ્યવૃતિ આપવા કે એવા ખાસ નક્કી કરેલા હેતુપૂર્વક જે દાન મળેલ હશે તેનો ઉપયોગ તેજ હેતુ માટે કરવામાં આવશે. પરંતુ હેતુ પરીપૂર્ણ ન થાય અથવા થવામાં વિઘ્ન આવે તો સંજોગો અનુસાર તેના ઉપયોગમાં ફેરફાર સંરક્ષક સમિતિ કરશે.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n48/mode/1up

realpatidar.com

(૩) કોઇ સજ્જન કોરી ૫૦૦૦) પાંચહજાર સામટી આપીને વિદ્યાર્થીનો નિયત શિક્ષણ કામ કાંઇ આપ્યા સિવાય પૂર્ણ કરાવી શકે છે.

(૪) ગુરૂકુળને કોઇપણ સજ્જન કોરી ૧૫૦૦૦) પંદરહજાર દાન આપીને પોતાના નામની એક કાયમની શિષ્યવૃતિ સ્થાપી શકશે અને કાયમને માટે એક વિદ્યાર્થીને ગુરૂકુળમાં દાખલ કરી શકશે.

(૫) ગુરૂકુળના ઉદ્દેશ્યો અને હેતુઓનો જેથી ભંગ થતો હોય તેવા પ્રકારનું દાન સ્વીકારી શકાશે નહિ.

(૨૫) क ઉપર લખેલા નિયમોમાં ફેરફાર કરવાનો અધિકાર સંરક્ષક સમિતિનો છે.

ख વિવાદાસ્પદ વિષયોમાં નિર્ણય સંરક્ષક સમિતિનો રહેશે. પણ તેમાંથી વિદ્યાર્થીના વાલી ઓછામાં ઓછી કોરી ૩૦ ત્રીસ સુધી આપે અને તે એક સામટી એક સત્રની એટલે છ માસની માસની આપે તો સમિતિ સ્વીકારી તેવા વિદ્યાર્થીને ઉપલી શરતો અનુસાર દાખલ કરી શકશે પણ વસ્ત્રો, પાઠ્ય પુસ્તકો સ્ટેશનરી, સાબુ, તેલ વિગેરેનો ખર્ચ વાલી પર છે.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n49/mode/1up

realpatidar.com

સં. ૧૯૯૫ ના પોશ શુદ ૧ થી સં. ૧૯૯૬ ના ચૈત્ર વદિ ૦)) સુધી માસ ૧૭ નું સામાન્ય સભામાં રજુ થયેલ સરવૈયું.

જ		ઉ	
૨૩૭૪।।। ૨।।	શ્રી શિષ્યવૃત્તિ ફંડ ખાતે જમા	૮૫૨।। ૪	શ્રી સેન્ટ્રલ બેન્ક ખાતે
૧૩૦૯। ૧	શ્રી બ્રહ્મચારી ફંડ ખાતે જમા.	૧૮૬૪૦૧।। ૩।।	શ્રી મકાન સ્થાવર ખાતે
૪૦૦૫૦૮।।। ૧।।	શ્રી સામાન્ય દાન ખાતે જમા.	૧૦૨૭૦)	શ્રી વસ્તુ બાલાંસ ખાતે
૪૯૧૦)	શ્રી અનામત બ્રહ્મચારી ખાતેજમા.	૭૨૯૭) ૨	શ્રી કાપડ વસ્ત્ર ખાતે
૪૦૯૧૦૨।।૫		૩૨૯૮।।। ૧।।	શ્રી મોટર કાર ખાતે
		૨૮૦૦)	શ્રી કોઠાર ખાતે
		૧૦૦૦)	શ્રી વણાટશાળા ખાતે
		૬૦૩।।	શ્રી શીવણ કામ ખાતે
		૧૧૯૪૪૫। ૪	શ્રી ગુરૂકુળ એકંદર ખર્ચ ખાતે
		૧૬૯। ૧	ભા. પ્રેમજી હરીદાસને ખાતે
		૨૪૭૩। ૧।।	શ્રીમાન્ કુંવરજી ગોકળ ખાતે
		૨૧૨। ૫।।	શ્રી રૂપીઆ ખાતે રૂ. ૪૧।—।
		૧૫૯।।। ૩।।	શ્રીમાન્ વિશ્રામભાઇ વાલજી ખાતે
		૧૫૦૦)	શ્રી ખેતર નામે પઈ ખાતે
		૪૧૬૨૫)	પૂજ્ય મહારાજ શ્રી ઉદ્ધવદાસજીને ખાતે રૂ. ૭૫૦૦)
		૧૪૩૩।।। ૨।।	શ્રી બ્રહ્મચારીઓના ખાતે
			૩૭૯૫૪૨।।૫
		૨૯૬૫૦)	શ્રી પ્રાંત છે.
			૪૦૯૧૦૨।।૫

આ પોતામેળ મેં તપાસ્યો ખાતાના ચોપડા રોકડા મેળવા ઉચરો સાથે મેળવી તપાસ્યા છે મારી માન્યતા મુજબ ઉપરનો હિસાબ ખરો અને પદ્ધતિસર છે.

વાલજી રત્ના રાઠોડ.
ઓડીટર શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n50/mode/1up

realpatidar.com

સં. ૧૯૯૬ ના વૈશાખ શુદ ૧ થી સં. ૧૯૯૮ ના આસો વદ ૦)) સુધી સામાન્ય સભામાં રજુ થયેલ

સરવૈયું.

જ

૨૨૪૩)૪ાા	શ્રી શિષ્યવૃતિ ફંડ ખાતે જમા.
૧૩૨૬ા)૨ાા	શ્રી બ્રહ્મચારી ફંડ ખાતે જમા.
૪૦૯૪૦૧ાા)૩ાા	શ્રી સામાન્ય દાન ખાતે જમા.
૧૫૮૦)	શ્રી અનામત બ્રહ્મચારીઓ ખાતે જમા.
૧૩૩૯૯)	શ્રી બ્રહ્મચારીઓના શુલ્ક ખાતે જમા.
૬૮૧)	શ્રી વાર્ષિક સભ્ય ખાતે જમા.
૧૧૨)	શ્રી વસ્તુદાન ખાતે જમા.
૫૭૬૩૨)૩	શ્રી ભૂમિદાન ખાતે જમા.
૬૭૮)	શેઠ લક્ષ્મીદાસ હંશરાજને ખાતે જમા
૧૯)	શ્રી માંડણભાઇ ભાણજીના ખાતે જમા.
૭૨૧૨ાાા	શ્રી વિદ્યાદાન ખાતે જમા.
૧૯૧૬)૧ાા	શ્રી ગૌશાળા ખાતે જમા.
૪૯૬૨૭૧ા૩	

ઉ

૮૫૨ાા ૪	ધી સેન્ટ્રલ બેન્ક ખાતે
૧૮૬૪૦૧ાા ૩ાા	શ્રી મકાનસ્થાવર ખાતે
૧૦૩૩૩ાા)૧ાા	શ્રી વસ્તુ બાલાંશ ખાતે
૧૫૦૦)	શ્રી ખેતર નામે પઇ ખાતે
૪૮૫૭ાાા ૩ાા	શ્રી કોઠાર ભંડાર ખાતે
૧૧૨૨ાાા ૫ાા	શ્રી વણાટશાળા ખાતે
૧૫૩ાા	શ્રી શીવણ કામ ખાતે
૧૨૪૫૫૮)૩	શ્રી ગુરૂકુળ એકંદર ખર્ચ ખાતે
૯૯૨૨ા ૫	શ્રી વિદ્યાલય શિક્ષણ ખાતે
૧૦૭ા ૫	શ્રી કાર્યાલય ખાતે
૨૪૧૪ાાા ૧ાા	શ્રી પાલનપોષણ ખાતે
૧૭૦૦૯ા ૦ાા	શ્રી ભોજન ખર્ચ ખાતે
૭૨૫ા ૫ાા	શ્રી અતિથિ સત્કાર ખાતે
૧૨૦)	શ્રી પ્રબંધ ખર્ચ ખાતે
૩૪૬ા ૩	શ્રી સફાઇ ખાતે
૪૮૦ાાા ૩	શ્રી મરામત ખાતે
૫૨૫ાા ૨ાા	શ્રી ચિકિત્સાલય ખાતે
૩૪૫ાા	શ્રી બગીચા ખાતે
૪૧૮)૧ાા	શ્રી પુસ્કાલય ખાતે
૫૭ા ૫	શ્રી પાઠ્ય પુસ્તકો ખાતે
૧૧૭૪)૫	શ્રી જલપ્રબંધ ખાતે
૪૩૨ા ૧	શ્રી ગુરૂકુળ પ્રચાર ખાતે
૮૦૫૫)	શ્રી રૂપીઆ ખાતે
	રૂ. ૧૬૧૩ાા≋ાા

realpatidar.com

realpatidar.com

જ	ઉ	
	૯૮ ૩	શ્રી પોસ્ટેજ ખાતે
	૪૬)પા।	શ્રી સ્ટેશનરી ખાતે
	૧૧૨૯૪૭)૧	શ્રી વાડી ખાતે
	૭૮)	ભાઇ જીવણ કુંવરજીને ખાતે
	૨૪૭૩। ૧।।	ભાઇ કુંવરજી ગોકળને ખાતે
	૧૪।।૨।।	ભાઇ હાના પંચાણ ખાતે
	૫૦૦)	હા. કુંવરજી નરસિંહને ખાતે
	૭૫)	અધ્યાપક હરજી જીવરાજને ખાતે
	૩૪।। ૫	માલા હાજાને ખાતે
	૧૦૬। ૪।।	શ્ર પ્રવાસ ખાતે
	૨૧૫૪।	ભાઇ અરજણ વાલજીને હસ્તે ખાતે
	૧૯૦।।	શ્રી બ્રહ્મચારીઓને ખાતે
	૫૫૨૩।। ૩	શ્રી કાપડ ખાતે
	૪૯૬૧૫૮।। ૨।।	
	૧૧૨।। ૦।।	શ્રી પ્રાંત છે.
	૪૯૬૨૭૧। ૩	

વાલજી રતના રાઠોડ માધાપુર
માજી ઓડિટર :શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ

આ હિસાબ તા. ૨૩-૧૧-૪૧ ની સભામાં રજુ થતાં સર્વાનુમતે મંજુર કરવામાં આવે છે.

સિ. મનજી જેરામની સહી દાઃ પોતાના
આજની સભાના પ્રમુખ

realpatidar.com

https://archive.org/details/bk785/page/n52/mode/1up

realpatidar.com

સં. ૧૯૯૮ ના કાર્તક શુદ ૧ થી સં. ૧૯૯૯ ના માગશર વદ ૪ સુધી દાનદાતાઓની સભામાં રજુ થયેલ

સરવૈયું.

જમા — ઉધાર

૫૦૮૩૯૦।)૪	શ્રી સામાન્ય દાન ખાતે જમા	૧૯૭૯૬૫। ०।।	શ્રી મકાન સ્થાવર ખાતે
૭૫૪)૪।।	શ્રી વાંઢાયના ગરાસીઆ ખાતે જમા	૧૫૦૦)	શ્રી ખેતર નામે ભ્રાતર ખાતે
૨૦)	ભાઈ જાદવજી રતનશીના ખાતે જમા	૧૨૪૭૫)	શ્રી વસ્તુ બાલાંશ ખાતે
		૨૫૧૦।।। ૫	શ્રી કોઠાર ભંડાર ખાતે
૫૦૯૧૬૪।। ૨।।		૨૦૬૮૩૪।। ०।।	શ્રી ગુરૂકુળ એકંદર ખર્ચ ખાતે
		૮૯૩૯०।। ૩।।	શ્રી વાડી ખાતે ઉધાર
		૩૦૦)	ડા. કુંવરજી નરસિંહને ખાતે
		૪૭૪)	આયર માલા હાજાને ખાતે
		૨૦૦)	શ્રી રેહાવણાટશાળા ખાતે
		૧૬૯।। ૪।।	સીંધલ પુંજાજી લાધાજીને ખાતે
		૧૮૫૭)૫	શ્રી રૂપીઆ ખાતે રૂા. ૫૩૧=।।
		,૨૬।। ०।।	શ્રી બ્રહ્મચારીઓને ખાતે
			૫०૪૩०૪। ૧।।
		૪૮૬०। ૧	શ્રી પ્રાંત છે
			૫०૯૧૬૪।। ૨।।

ઓડીટ કરવામાં આવ્યું તા. ૨૬–૧૨–૪૨

વાલજી રતના રાઠોડ માધાપુર

માજી ઓડીટર શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ

(ભિક્ષુ ઉદ્ધવદાસજી ગુરૂલાલરામજીની સહી દાઃ પોતાના

રૂ૫રૂ તા. ૨૭–૧૨–૪૨ ની સભાના પ્રમુખ

સાધ્વી મૈયાજીની સહી.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n53/mode/1up

1943 -Ishwar Ramji Gurukul -Annual Report (785)

realpatidar.com

: શ્રી ઇશ્વરરામજી ગુરૂકુળ વિદ્યાલય. :

પૂજ્ય મહારાજ શ્રી ઉદ્ધવરામજી જેમના શુભ પ્રયત્નના પરિણામે આ સંસ્થા સ્થપાઇ, તેઓ આ સંસ્થાના અધિચાલક તથા મુખ્યાધિષ્ઠાતાના હોદ્દે હતા. તેઓ પોતાના આધ્યાત્મિક ક્ષેત્રમાં જવા માંગતા હોવાથી સંસ્થાના ગુરૂદ્વારાના કાર્યમાંથી મુકત થઇ નિવૃત્ત થયા છેજ.

પૂજ્યપાદ ઇશ્વરરામજી મહારાજનું આ સ્મારક કાયમી જળવાઇ રહે અને સંસ્થાનું સંચાલન બરાબર ચાલે તે માટે તેમણે આ સંસ્થાના હિદીમાં રસ લેતા બાવીસ સભ્યોની સંરક્ષક સમિતિ નીમી છે. જે સમિતિએ આ સંસ્થાના સંચાલનનો ભાર પોતા ઉપર લીધો છે.

આ સમિતીના ૧૩ સભ્યો કચ્છના અને ૯ મુંબઇ વસતા કચ્છી ભાઇઓ છે જેમના નામ આ રિપોર્ટમાં અન્ય સ્થળે આપવામાં આવેલ છે. આ સંરક્ષક સમિતિની એક સભા તા. ૨૧-૨-૪૩ ને રોજ ઇશ્વરનગર મધે એકઠી મલી હતી તેમાં મોટાભાગનાં સભ્યોએ હાજરી આપી હતી મુંબઇના કેટલાક સભ્યો આ સમિતિમાં હાજરી આપવા મુંબઇથી પધાર્યા હતા.

સંસ્થાને પ્રગતિ અને વિકાસ કરવા માટે યોજનાઓ વિચારવામાં આવી હતી. શિક્ષણનો પ્રશ્ન વિચારવા એક શિક્ષણ સમિતિ સંસ્થાની આંતરિક વ્યવસ્થા માટે એક વ્યવસ્થાપક સમિતિ તથા બંધારણ સમિતિ નીમવામાં આવી હતી. સંસ્થાની આર્થિક બાજુનો વિચાર કરતાં સ્થાયી ફંડ કરવાની આવશ્યકતા જણાઇ હતી. દરમિયાન સંસ્થાના ચાલુ નિભાવ માટે વાર્ષિક રૂા. ૧૦૦૦૦) દશહજાર વાર્ષિક સભ્યો નોંધી એકઠા કરવા સમિતિએ ઠરાવ્યું છે, અને સભામાં તેજ વખતે કેટલાક વાર્ષિક સભ્યો તાત્કાલિક નોંધાઈગયા હતા. ઓછામાં ઓછા રૂા. ૧૦) દશ કે કોરી ૩૦) ત્રીસ કે તેથી વધુ રકમ આપનાર વાર્ષિક સભ્ય બની શકશે તેવું ઠરાવવામાં આવ્યું હતું આ સંસ્થામાં મુખ્યત્વે ગરીબ વિદ્યાર્થીઓને વિના શુલ્કે ભણાવવા તેવો સંસ્થાના સ્થાપક શ્રીનો ઉદ્દેષ છે.

અત્યારે સંસ્થાનો ૩૬ બ્રહ્મચારીઓ લાભ લે છે. પણ આ સમિતિએ ચાલુ સાલમાં નવા સત્રમાં નિઃશુલ્ક પાલનપોષણ મેળવનાર વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ૫૦ સુધીની રાખવા ઠરાવ્યું છે. જેઓ પુરી ફી અને અર્ધી ફી આપી સંસ્થાનો લાભ લેવા માગતા હશે, તેવા બ્રહ્મચારીઓને પણ દાખલ કરવામાં આવશે.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com

https://archive.org/details/bk785/page/n54/mode/1up

realpatidar.com

આ ઉપરથી જોઇ શકાશે કે સંરક્ષક સમિતિ સંસ્થાને પ્રગત્તિના પંથે આગળ લઇ જવા માટે પોતાના બનતા પ્રયત્નો અને પુરૂષાર્થ કરી રહી છે તેમાં સાથ અને સહકાર આપવા કચ્છના સમગ્ર ભાઇ બ્હેનોને આગ્રહભરી અમારી વિનંતિ છે.

પ્રજાની સહાયથી ઉભી થએલ કચ્છની આ સાર્વજનિક શિક્ષણ સંસ્થાને બહોળા હાથે મદદ કરવા કચ્છના ઉદાર અને શિક્ષણ પ્રેમી ભાઇ બહેનો આગળ આવશે તેવી અમને શ્રદ્ધા છે. અને તે વિશ્વાસે અમે આ બધી યોજનાઓ ઘડી રહ્યા છીએ અને સૌનો તન, મન, અને ધનથી સહકાર માગીએ છીએ.

: સંસ્થાને મકાન બંધાવી આપનાર દાતાઓના નામો :

૧ વિદ્યાલયનું વિશાળ મકાન (ઓરડા ૧૩) સં. ૧૯૯૫

રૂા. ૧૦૦૦) ગામ શ્રી માધાપુર નિવાસી શ્રીમાન્ શ્રી મનજીભાઇ જેરામભાઇએ પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે એક રૂમ.

રૂા. ૨૦૦૦) રૂમ ૨ ગામ શ્રી માધાપુર નિવાસી શ્રીમાન્ રઘુભાઇ તથા કુંવરજીભાઈ તથા દામજીભાઇ તથા શ્રી વેલજીભાઈ તથા ભવાનજીભાઇ કરસનભાઇએ તેમના પિતાશ્રી તથા પૂ. માતુશ્રીના સ્મરણાર્થે.

રૂા. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી માધાપુર નિવાસી શ્રીમાન્ મી. હરજીવનભાઈ તથા શ્રી વાલજીભાઇ તથા શ્રી લાલજીભાઇ માધવજીભાઇએ તેમના પૂ. માતુશ્રીની સંમતીથી તેમના પિતાશ્રીના સ્મર્ણાર્થે.

રૂા. ૧૦૦૦) રૂમ ૧ ગામ શ્રી માધાપુર નિવાસી સ્વર્ગસ્થ શ્રીમાન્ જગમાલભાઇ ભીમજીના સ્મરણાર્થે તેમના ધર્મપત્નિ બાઇ ભાણીબાઇએ બંધાવી આપેલ.

રૂા. ૧૦૦૦) રૂમ ૧ ગામ શ્રી હાજાપુર નિવાસી શ્રીમાન ખેંગારભાઇ રતનાએ પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે.

રૂા. ૧૦૦૦) રૂમ ૧ ગામ શ્રી હાજાપુર નિવાસી મી. શ્રી હરજીભાઇ વિશ્રામે પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n55/mode/1up

realpatidar.com

રૂા. ૧૦૦૦) રૂમ ૧ ગામ શ્રી નાગોર નિવાસી શ્રીમાન મી. ભોજાભાઇ ખીમજી ચૌહાણે પોતાના માતુશ્રીના સ્મરણાર્થે.

રૂા. ૧૦૦૦) રૂમ ૧ ગામ શ્રી નાગોર નિવાસી શ્રીમાન્ માવજીભાઈ પૂંજા પાંચાણીએ પોતાના પિતાશ્રીના સ્મરણાર્થે.

રૂા. ૧૦૦૦) રૂમ ૧ શ્રીમાન્ શુરજીભાઇ વલ્લભદાસ (મુંબઇ) તરફથી પોતાના માતુશ્રીના સ્મરણાર્થે.

રૂા. ૩૦૦૦) રૂમ ૨ તથા એક સિંહદ્વાર ગામ શ્રી માધાપુર નિવાસી શ્રીમાન્ મીસ્ત્રી વિશ્રામભાઈ તથા અમૃતલાલભાઇ વાલજીભાઇએ તેમના સ્વર્ગસ્થ પિતાશ્રીના સ્મર્ણાર્થે.

વ્યાયામશાળા સં.-૧૯૯૩.

કો. ૪૦૦૦) ગામ શ્રી દરસડીવાલા ઠા. ઓધવજીભાઇ રવજીના સ્મર્ણાર્થે ઠા. લાલજીભાઇ રવજી ખાંટે બંધાવી આપેલ છે.

ચિકિત્સાલય સં. ૧૯૯૩.

કો. ૬૦૦૦) ગામ શ્રી હાજાપુર નિવાસી મીસ્ત્રી હીરજીભાઇ વિશ્રામ પરમારે બંધાવી આપેલ છે.

છાત્રાલાસ સં.-૧૯૯૩.

કો. ૩૭૫૦૦) ગામ શ્રી કુકમાવાસીઓએ નીચે દર્શાવેલા નામો પ્રમાણે બંધાવી આપેલ છે.

કો. ૧૦૩૧૨) શ્રી પ્રેમજીભાઇ કલ્યાણજી પરમારના સ્મર્ણાર્થે હસ્તે તેમનાં સુપુત્રો.

,, ૮૦૦૦) શ્રી ઘેલાભાઈ પ્રેમજી પરમારે તેમના સ્વર્ગસ્થ પુત્રો માધવજી તથા શિવજીનાં સ્મર્ણાર્થે.

,, ૩૭૫૦) શ્રી કલ્યાણજીભાઇ ખેંગાર પરમાર

,, ૨૫૦૦) શ્રી પ્રેમજીભાઈ પાંચા ટાંક.

,, ૨૦૦૦) શ્રી પ્રેમજીભાઇ દેવશી પરમાર હસ્તે તેમના સુપુત્રો શ્રી ઘેલાભાઇ પ્રેમજીભાઇ

,, ૧૨૫૦) શ્રી વાલજીભાઈ લીરા રાઠોડ

realpatidar.com

https://archive.org/details/bk785/page/n56/mode/1up

realpatidar.com

કો. ૨૦૦૦) શ્રી દાનાભાઇ પંચાણ પરમાર
,, ૧૧૦૦) શ્રી વીરાભાઇ મનજીભાઇ ટાંક હસ્તે તેમના સુપુત્રો શ્રી મેઘજીભાઇ તથા શ્રી રૂપાભાઇ
,, ૧૦૦૧) શ્રી ભોજાભાઈ નાથા ટાંક
,, ૧૦૦૦) શ્રી ગોપાલભાઇ પંચાણ પરમાર
,, ૭૫૦) શ્રી મેગરભાઇ જેઠા ચૌહાણ
,, ૫૨૫) શ્રી પ્રેમજીભાઇ કચરા રાઠોડના સ્મર્ણાર્થે હસ્તે તેમના સુપુત્રો.
,, ૫૦૦) શ્રી રતનાભાઇ પંચાણ પરમાર
,, ૨૮૧૨) ૫૦૦ થી ઓછી રકમના ફાળાની.

૩૭૫૦૦)

પરિવારગૃહ સં.-૧૯૯૩.

રૂા. ૩૨૦) રૂમ ૧ ગામ શ્રી કોટડીવાલા ઠા. ઓધવજી જેઠમલના સ્મર્ણાર્થે તેમના ધર્મપત્નિ બાઇ ખીઆંબાઇ તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી રોહાવાલા ઠા. નારાણદાસભાઇ તુલસીદાસ શૂરજીના સ્મર્ણાર્થે બાઇ મોંઘીબાઇ તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી કોજાચોરાવાલા ઠા. ગોકુલદાસભાઇ શામજી તરફથી.

રૂા. ૩૨૦) રૂમ ૧ ગામ શ્રી બિદડાવાલા રાજગોર શ્રી કાનજી વેલજીનાં સ્મર્ણાર્થે તેમના સુપુત્ર વિશનજી કાનજી તરફથી

રૂા. ૩૧૧) રૂમ ૧ ગામ શ્રી અંજારવાલા લુહાણા શ્રી રાઘવજીભાઈ ત્રીકમજીએ તેમનાં ધર્મપત્નિ તેજબાઇના સ્મર્ણાર્થે.

રૂા. ૨૧૧) રૂમ ૧ ગામ શ્રી રૂઅરવાલા મરહુમ લુહાણા શ્રી ખીમજીભાઇ મનજીના સ્મર્ણાર્થે તેમનાં ધર્મપત્નિ વીરબાઇ તરફથી.

રૂા. ૨૧૩) રૂમ ૧ ગામ શ્રી મંજલ (હમલાવાલા) લુહાણા ઠા. બાઇ જીવાબાઈ તરફથી

realpatidar.com

https://archive.org/details/bk785/page/n57/mode/1up

realpatidar.com

રૂા. ૨૧૩) રૂમ ૧ સ્વર્ગસ્થ શેઠ નારાણજી શૂરજીના સ્મણાર્થે તેમનાં ધર્મપત્નિ બાઇ આગબાઇ તથા તેના સુપુત્ર હીરજી નારાણજી કલ્યાણપુરવાલા તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી રેહાવાલા ઠા. લધા પુરૂષોત્તમના સ્મણાર્થે તેમના ધર્મપત્નિ બાઇ પ્રેમાબાઈ તરફથી.

ભોજનાલય સં.-૧૯૯૩

કો. ૧૫૦૦૦) શ્રી માધાપુર નિવાસી મીસ્ત્રી શ્રી વાલજીભાઇ ભીમજી તથા શ્રી મનજીભાઇ જેરામ રાઠોડે બંધાવી આપેલ છે.

સ્નાનગૃહ

કો. ૧૨૫૦) ગામ શ્રી ભુજ નિવાસી ઠા. પ્રેમજીભાઇ તેજપાલના સ્મણાર્થે તેમના ધર્મપત્નિ બાઇ મૂલબાઇ તરફથી.

તળાવ પાસેની મોટી ટાંકી (તેના સાધન સહિત) સં.-૧૯૯૩

રૂા. ૫૦૧) ગામ શ્રી અંજારવાલા ઠા. શ્રી પ્રેમજીભાઇ હીરજી શેઠીઆના સ્મણાર્થે તેમનાં ધર્મપત્નિ બાઇ ગંગાબાઇ તરફથી.

રૂા. ૩૫૦૯ા જલપ્રબંધનાં ખર્ચ માટે મળેલ દાન સં. ૧૯૯૬ જેમના નામો આ રિપોર્ટમાં અન્ય સ્થળે આપવામાં આવ્યા છે.

અતિથિગૃહો

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી ગઢશીશાવાલા ઠા. રામજીભાઇ હંશરાજના સ્મણાર્થે તેમના ભાઇ લક્ષ્મીદાસ હંશરાજ તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી મંજલવાલા ભાટિઆ ઈબજી પારપૈયાના સ્મણાર્થે તેમના ધર્મપત્નિ બાઇ માણેકબાઈ તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી ભુજવાલા ઠા. પ્રેમજીભાઇ જાદવજીના સ્મણાર્થે તેમનાં ધર્મપત્નિ બાઇ ભાગબાઇ તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી બિદડાવાલા ઠા. પ્રાગજીભાઈ લધા તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી મસ્કવાળા સ્વર્ગવાસી ઠા. લક્ષ્મીદાસભાઇ ટોપણના સ્મણાર્થે તેમનાં ધર્મપત્નિ બાઇ મીઠીબાઇ તરફથી.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n58/mode/1up

realpatidar.com

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી કલ્યાણપુરવાલા ડા. પ્રાગજી સુંદરજી દેવચંદના સ્મર્ણાર્થે ચી. કરશનદાસના દાદીમાં મોંઘીમા તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ શ્રી ખીમજીભાઇ ટોપણ તથા માતુશ્રી કુંવરબાઇના સ્મર્ણાર્થે ભાનુશાલી ધીરાજી તથા દયાળ ડોસા તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી રતડીઆવાલા ડા. ખીમજીભાઈ કેશવજીભાઈનાં સ્મર્ણાર્થે તેમનાં ધર્મપત્નિ બાઈ ડાહીબાઇ તરફથી.

કો. ૧૦૦૧) રૂમ ૧ ગામ શ્રી જખૌબંદરવાલા ભા. વેલજીભાઇ જાદવજી રતનશી તરફથી.

કો. ૧૫૦૦) રૂમ ૧ ગામ શ્રી મંજલવાલા ડા. વિશ્રામ ટોપણના સ્મર્ણાર્થે તેમના પુત્ર ડા. વિરજીભાઇ વિશ્રામ તરફથી.

કો. ૧૫૦૦) રૂમ ૧ ગામ શ્રી ભુજવાલા ડા. મોનજી લાલજીના સ્મર્ણાર્થે તેમનાં ધર્મપત્નિ બાઇ રામાબાઇ તરફથી.

કો. ૧૫૦૦) રૂમ ૧ સ્વર્ગસ્થ જાડેજા દીપસંગજી ઉમેદસંગજીના સ્મર્ણાર્થે તેમના પુત્ર રવિસંગજી તરફથી.

કો. ૧૫૦૦) રૂમ ૧ સાધુ શ્રી પુંજારામજી ગુરૂ ત્રીકમદાસજી ગામ શ્રી નિરોણાવાલા તરફથી.

કો. ૧૦૦૦) રૂમ ૧ ડા. તુલસીદાસભાઇ પુરૂષોત્તમદાસના સ્મર્ણાર્થે ગામ શ્રી મોટાઆસંબીઆના બાઇ કલ્યાણ બાઇ તરફથી.

પુસ્તકાલય

કો. ૨૦૦૦) ગામ શ્રી ફરાદીઆના સ્વર્ગવાસી ડા. ભાણજી પુરૂષોત્તમના સ્મર્ણાર્થે તેમનાં ધર્મપત્નિ બાઇ ગોમાબાઈ તરફથી પુસ્તકો માટે.

realpatidar.com

https://archive.org/details/bk785/page/n59/mode/1up

realpatidar.com

realpatidar.com

https://archive.org/details/bk785/page/n60/mode/1up

realpatidar.com

કુલ–ગીત.

પ્રાણો કે દેનેવાલી, ગુરૂકુળ તું મેરી માતા !
અમૃત પિલાનેવાલી. ગુરૂકુળ તું મેરી માતા ॥૧॥

તેરી વિજય પતાકા, ઉસ ઓમ કી ધ્વજાકો !
મન મેરા દેખ માતા, ફૂલા નહિ સમાતા ॥૨॥

ગોદીમેં તેરી આકર. વિદ્યાકા દૂધ પીકર !
ઇસ દોષી દેહકો ભી, મૈં ધન્ય હૂં મનાતા ॥૩॥

નિજ દેશ ઔર તેરી, સેવામેં માતુ અપને !
રણદેંગે વે સુભાગે, કર ખંડ ખંડ ગાતા ॥૪॥

બાદલ ઉમડને કોહે, છાને કો હૈ અંધેરા !
બત્તી બને જલેંગે, તેરે સુપૂત માતા ॥૫॥

ભારતકી એક આશે, પુત્રો કે પાપ નાશે !
યહ શીશ હૈ તુમ્હારે, ચરણોમેં આજ માતા ॥૬॥

realpatidar.com

https://archive.org/details/bk785/page/n61/mode/1up

realpatidar.com

SHREE JAIN BHASKARODAYA P. PRESS
JAMNAGAR.

realpatidar.com

Link: http://www.realpatidar.com/library
email: mail@realpatidar.com